



# सेंट सरल भाषा ँ शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

## गुजराती भाषा नुं सरल ज्ञान गुजराती भाषा का सरल ज्ञान Easy Learning of Gujrati Language

(हिन्दी Hindi – अँग्रेजी English – गुजराती Gujrati)

केन्द्रीय कार्यालय (राजभाषा विभाग), मुम्बई

## गुजराती भाषा नी वर्णमाळा गुजराती भाषा की वर्णमाला

### Consonants

ક	ખ	ગ	ઘ	ઙ	ચ	છ	જ	ઝ	ઞ
ka	kha	ga	gha	ṅa	ca	cha	ja	jha	ña
[kə]	[kʰə]	[gə]	[gʱə]	[ŋə]	[tʃə]	[tʃʰə]	[dʒə]	[dʒʱə]	[nə]
ટ	ઠ	ડ	ઢ	ણ	ત	થ	દ	ધ	ન
ṭa	ṭha	ḍa	ḍha	ṇa	ta	tha	da	dha	na
[t̪ə]	[t̪ʰə]	[d̪ə]	[d̪ʱə]	[ɳə]	[tə]	[tʰə]	[də]	[dʱə]	[nə]
પ	ફ	બ	ભ	મ	ય	ર	લ	વ	
pa	pha	ba	bha	ma	ya	ra	la	va	
[pə]	[fə]	[bə]	[bʱə]	[mə]	[jə]	[rə]	[lə]	[və]	
શ	ષ	સ	હ	ળ	ક્ષ	જ્ઞ			
śa	ṣa	sa	ha	ḷa	kṣa	jña			
[ʃə]	[ʃə]	[sə]	[ɦə]	[ɭə]	[kʃə]	[dʒnə]			

ગણતરી ગિનતી Counts

હિન્દી		અંગ્રેજી		ગુજરાતી			
				ગુજરાતી		દેવનાગરી લિપિ	રોમન લિપિ
૧	એક	1	ONE	૧	એક	एक	Eka
૨	દો	2	TWO	૨	બે	बे	be
૩	ત્રીન	3	THREE	૩	ત્રણ	त्रण	trana
૪	ચાર	4	FOUR	૪	ચાર	चार	Ca ra
૫	પાંચ	5	FIVE	૫	પાંચ	पांच	pcaan
૬	છહ	6	SIX	૬	છ	छ	cha
૭	સાત	7	SEVEN	૭	સાત	सात	sata
૮	આઠ	8	EIGHT	૮	આઠ	आठ	aṭha
૯	નૌ	9	NINE	૯	નવ	नव	nava
૧૦	દસ	10	TEN	૧૦	દસ	दस	TEN
૧૧	ગ્યારહ	11	ELEVEN	૧૧	અગચાર	अगियार	agiyara
૧૨	બારહ	12	TWELVE	૧૨	બાર	बार	bara
૧૩	તેરહ	13	THIRTEEN	૧૩	તેર	तेर	tera
૧૪	ચૌદહ	14	FOURTEEN	૧૪	ચૌદ	चौद	chauda
૧૫	પંદ્રહ	15	FIFTEEN	૧૫	પંદર	पंदर	pandara
૧૬	સોલહ	16	SIXTEEN	૧૬	સોળ	सोळ	soḷa
૧૭	સત્રહ	17	SEVENTEEN	૧૭	સત્તર	सत्तर	sattara
૧૮	અઠારહ	18	EIGHTEEN	૧૮	અઢાર	अढार	aḍhara
૧૯	ઉત્ત્રીસ	19	NINETEEN	૧૯	ઓગણીસ	ओगणीस	ogaṇisa
૨૦	બીસ	20	TWENTY	૨૦	વીસ	वीस	visa
૨૧	ઇક્કીસ	21	TWENTY ONE	૨૧	એકવીસ	एकवीस	ekavisa
૨૨	બાઈસ	22	TWENTY TWO	૨૨	બાવીસ	बावीस	bavisa
૨૩	તેઈસ	23	TWENTY THREE	૨૩	ત્રેવીસ	त्रेवीस	treivsa
૨૪	ચૌબીસ	24	TWENTY FOUR	૨૪	ચોવીસ	चोवीस	chovisa
૨૫	પચ્ચીસ	25	TWENTY FIVE	૨૫	પચ્ચીસ	पच्चीस	paccisa

ગણતરી ગિનતી Counts

હિન્દી		અંગ્રેજી		ગુજરાતી			
				ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ	
૨૬	છબ્બીસ	26	TWENTY SIX	૨૬	છવ્વીસ	छव्वीस	chavvisa
૨૭	સત્તાઈસ	27	TWENTY SEVEN	૨૭	સત્યાવીસ	सत्यावीस	sattavisa
૨૮	અઢ્ઢાઈસ	28	TWENTY EIGHT	૨૮	અઢ્યાવીસ	अठ्यावीस	aṭhayavisa
૨૯	ઉનતીસ	29	TWENTY NINE	૨૯	ઓગણત્રીસ	ओगणत्रीस	ogaṇatrisa
૩૦	તીસ	30	THIRTY	૩૦	ત્રીસ	त्रीस	trisa
૩૧	ઇકતીસ	31	THIRTY ONE	૩૧	એકત્રીસ	एकत्रीस	ekatrisa
૩૨	બત્તીસ	32	THIRTY TWO	૩૨	બત્રીસ	बत्रीस	batrisa
૩૩	તૈતીસ	33	THIRTY THREE	૩૩	તેત્રીસ	तेत्रीस	tetrisa
૩૪	ચૌતીસ	34	THIRTY FOUR	૩૪	ચોત્રીસ	चोत्रीस	chotrisa
૩૫	પૈતીસ	35	THIRTY FIVE	૩૫	પાત્રીસ	पात्रीस	patrisa
૩૬	છત્તીસ	36	THIRTY SIX	૩૬	છત્રીસ	छत्रीस	chatrisa
૩૭	સૈતીસ	37	THIRTY SEVEN	૩૭	સાડત્રીસ	साडत्रीस	saḍatrisa
૩૮	અડતીસ	38	THIRTY EIGHT	૩૮	આડત્રીસ	आडत्रीस	aḍatrisa
૩૯	ઉનતાલીસ	39	THIRTY NINE	૩૯	ઓગણચાલીસ	ओगणचालीस	ogaṇa calisa
૪૦	ચાલીસ	40	FORTY	૪૦	ચાલીસ	चालीस	chalisa
૪૧	ઇકતાલીસ	41	FORTY ONE	૪૧	એકતાળીસ	एकताळीस	ekatalisa
૪૨	બયાલીસ	42	FORTY TWO	૪૨	બેતાળીસ	बेताळीस	betalisa
૪૩	તૈતાલીસ	43	FORTY THREE	૪૩	ત્રેતાલીસ	त्रेतालीस	tetalisa
૪૪	ચવાલીસ	44	FORTY FOUR	૪૪	ચૂમ્માલીસ	चूम्मालीस	chummalisa
૪૫	પૈતાલીસ	45	FORTY FIVE	૪૫	પીસ્તાલીશ	पीस्तालीश	chalisa pannca
૪૬	છિયાલીસ	46	FORTY SIX	૪૬	છેતાળીસ	छेताळीस	chetalisa
૪૭	સૈતાલીસ	47	FORTY SEVEN	૪૭	સુડતાલીસ	सुडतालीस	suḍatalisa
૪૮	અડતાલીસ	48	FORTY EIGHT	૪૮	અડતાળીસ	अडताळीस	aḍatalisa
૪૯	ઉનચાસ	49	FORTY NINE	૪૯	ઓગણપચાસ	ओगणपचास	ogaṇapachasa
૫૦	પચાસ	50	FIFTY	૫૦	પચાસ	पचास	pacasa

ગણતરી ગિનતી Counts

હિન્દી		અંગ્રેજી		ગુજરાતી			
				ગુજરાતી		દેવનાગરી લિપિ	રોમન લિપિ
૫૧	इक्यावन	51	FIFTY ONE	૫૧	એકાવન	एकावन	ekavana
૫૨	बावन	52	FIFTY TWO	૫૨	બાવન	बावन	bavana
૫૩	तिरपन	53	FIFTY THREE	૫૩	ત્રેપન	त्रेपन	trepana
૫૪	चौवन	54	FIFTY FOUR	૫૪	ચોપન	चौवन	chopana
૫૫	पचपन	55	FIFTY FIVE	૫૫	પંચાવન	पंचवन	panncavana
૫૬	छप्पन	56	FIFTY SIX	૫૬	છપ્પન	छप्पन	chappana
૫૭	सत्तावन	57	FIFTY SEVEN	૫૭	સત્તાવન	सत्तावन	sattavana
૫૮	अठ्ठावन	58	FIFTY EIGHT	૫૮	અઠાવન	अठ्ठावन	aṭhavana
૫૯	उनसठ	59	FIFTY NINE	૫૯	ઓગણસાઠ	ओगणसाठ	ogaṇasaith
૬૦	साठ	60	SIXTY	૬૦	સાઠ	साठ	saṭha
૬૧	इकसठ	61	SIXTY ONE	૬૧	એકસઠ	इकसठ	ekasaṭha
૬૨	बासठ	62	SIXTY TWO	૬૨	બાસઠ	बासठ	saṭha be
૬૩	तिरसठ	63	SIXTY THREE	૬૩	તેસઠ	तिरसठ	tresanṭha
૬૪	चौसठ	64	SIXTY FOUR	૬૪	ચોસઠ	चौसठ	chosanṭha
૬૫	पैसठ	65	SIXTY FIVE	૬૫	પાસઠ	पैसठ	pasanṭha
૬૬	छियासठ	66	SIXTY SIX	૬૬	છાસઠ	छियासठ	chasaṭha
૬૭	सड़सठ	67	SIXTY SEVEN	૬૭	સડસઠ	सड़सठ	saḍasaṭha
૬૮	अड़सठ	68	SIXTY EIGHT	૬૮	અડસઠ	अड़सठ	aḍasaṭha
૬૯	उनहत्तर	69	SIXTY NINE	૬૯	ઓગણસીતેર	ओगणसीतेर	ogaṇa sitera
૭૦	सत्तर	70	SEVENTY	૭૦	સીતેર	सत्तर	sittera
૭૧	इकहत्तर	71	SEVENTY ONE	૭૧	એકોતર	इकहत्तर	ekotara
૭૨	बहत्तर	72	SEVENTY TWO	૭૨	બોતેર	बहत्तर	botera
૭૩	तिहत्तर	73	SEVENTY THREE	૭૩	તોતેર	तिहत्तर	totera
૭૪	चौहत्तर	74	SEVENTY FOUR	૭૪	ચૂમ્મોતર	चौहत्तर	Choomotar
૭૫	पचहत्तर	75	SEVENTY FIVE	૭૫	પંચોતેર	पचहत्तर	pannchotera

ગણતરી ગિનતી Counts

હિન્દી		અંગ્રેજી		ગુજરાતી			
				ગુજરાતી		દેવનાગરી લિપિ	રોમન લિપિ
૭૬	છિહત્તર	76	SEVENTY SIX	૭૬	છોતેર	છોતેર	chhotera
૭૭	સતત્તર	77	SEVENTY SEVEN	૭૭	સત્તિયોતેર	સિત્યોતેર	sityotera
૭૮	અઠહત્તર	78	SEVENTY EIGHT	૭૮	અઠયોતેર	અઠયોતેર	athyotera
૭૯	ઉનાસી	79	SEVENTY NINE	૭૯	ઓગણએસી	ઓગણએસી	Ogan aisee
૮૦	અસ્સી	80	EIGHTY	૮૦	એસી	એસી	aisi
૮૧	ઠ્ઠક્યાસી	81	EIGHTY ONE	૮૧	એક્યાસી	એક્યાસી	ekyasi
૮૨	બ્યાસી	82	EIGHTY TWO	૮૨	બ્યાસી	બ્યાસી	byasi
૮૩	તિરાસી	83	EIGHTY THREE	૮૩	ત્યાસી	ત્યાસી	triyasi
૮૪	ચૌરાસી	84	EIGHTY FOUR	૮૪	ચોરાસી	ચોરાસી	choryasi
૮૫	પચાસી	85	EIGHTY FIVE	૮૫	પંચાસી	પંચાસી	panchasi
૮૬	છિયાસી	86	EIGHTY SIX	૮૬	છ્યાસી	છ્યાસી	chayasi
૮૭	સતાસી	87	EIGHTY SEVEN	૮૭	સત્યાસી	સિત્યાસી	Sityasee
૮૮	અઠ્ઠાસી	88	EIGHTY EIGHT	૮૮	અઠ્યાસી	અઠ્યાસી	Athyasee
૮૯	નવાસી	89	EIGHTY NINE	૮૯	નેવ્યાસી	નેવ્યાસી	Nevyasi
૯૦	નબ્બે	90	NINETY	૯૦	નેવું	નેવું	Nevu
૯૧	ઠ્ઠક્યાનબે	91	NINETY ONE	૯૧	એકાણું	એકાણું	ekaṇu
૯૨	બ્યાનબે	92	NINETY TWO	૯૨	બાણુ	બાણુ	baṇu
૯૩	તિરાનબે	93	NINETY THREE	૯૩	તાણુ	તાણુ	taṇu
૯૪	ચૌરાનબે	94	NINETY FOUR	૯૪	ચોરાણુ	ચોરાણુ	choraṇu
૯૫	પિચાનબે	95	NINETY FIVE	૯૫	પંચાણુ	પંચાણુ	panchaṇu
૯૬	છિયાનબે	96	NINETY SIX	૯૬	છન્નુ	છન્નુ	Channu
૯૭	સત્તાનબે	97	NINETY SEVEN	૯૭	સત્તાણુ	સત્તાણુ	satanu
૯૮	અઠ્ઠાનબે	98	NINETY EIGHT	૯૮	અઠ્ઠાણુ	અઠ્ઠાણુ	aṭṭhaṇu
૯૯	નિન્યાનબે	99	NINETY NINE	૯૯	નવ્વાણુ	નવ્વાણુ	navvaṇu
૧૦૦	એક સૌ	100	One HUNDRED	૧૦૦	એક સૌ	એક સૌ	eka so

ढोटी गणतरी / बडी गिनतियाँ / Big Counts

हिन्दी		अँग्रेजी		गुजराती			
				गुजराती		देवनागरी लिपि	रोमन लिपि
१०००	एक हजार	1000	One Thousand	१०००	अेक ँजार	एक हजार	Eka hajara
१००००	दस हजार	10000	Ten Thousand	१००००	दस ँजार	दस हजार	dasa hajara
१०००००	एक लाख	1000000	One Lakh	१०००००	अेक लाख	एक लाख	eka lakha
१००००००	दस लाख	10000000	One Milion	१००००००	दस लाख	दस लाख	dasa lakha
१०००००००	एक करोड	100000000	One Crore	१०००००००	अेक करोड	एक करोड	eka karoḁa
१००००००००	दस करोड	10000000000	One Hundred Milion	१००००००००	दस करोड	दस करोड	dasa karoḁa
१०००००००००	एक अरब	1000000000000	One Bilion	१००००००००००	अेक अरब	एक अरब	eka abaja

सर्वनाम Pronouns

क्रम	हिन्दी	अँग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	यह	This	आ	आ	Aa
2	वह	He / She / That	ते / तेषी / ते	ते / तेणी / ते	te / tenee / te
3	वे	They	तेओ	तेओ	teo
4	हम	We	अमे	अमे	ame
5	वे सभी	Those all	ते बधा	ते बधा	te badhaa
6	ये	These	आ	आ	aa
7	मैं	I	हुं	हुं	hun
8	तुम	You	तमे	तमे	tame
9	जो / कौन	Who	कोण	कोण	kon
10	आप	You	तमे	तमे	tame
11	कोई	Any	कोईपण	कोईपण	koiipan
12	मुझे	Me	मने	मने	mane
13	मेरा	My	मारा	मारा	maaraa
14	हमारा	Our	अमारा	अमारा	amaaraa
15	आपको	To You	तने	तने	tane
16	इन्हें	To these	आने	आने	aane
17	उन्हें	To them	तेमने	तेमने	temane
18	इसने	it	ते	ते	te
19	उसने	He	तेमणे	तेमणे	temane
20	उसे	To him / Her	तेने/तेणीने	तेने/तेणीने	tene/teneene
21	वैसा	like that	तेना जेवी	तेना जेवी	tenaa jevee
22	जिसकी	whose	जेनी	जेनी	jenee
23	उसकी	Her	तेणीना	तेणीना	teneenaa
24	जिसने	Whosoever	जे पण	जे पण	je pan
25	उन्होंने	They	तेओ	तेओ	teo
26	उसका	His	तेमना	तेमना	temanaa



વિશેષણ Adjective

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ઉત્સાહી	Enthusiastic	ઉત્સાહી	उत्साही	Utsaahee
2	ખુશ	Happy	ખુશ	खुश	khush
3	યુવા	Young	યુવાન	युवान	yuvaan
4	તેજ	Fast	ઝડપી	झडपी	jhadapee
5	શાંત	Quiet	શાંત	शांत	shaant
6	પૂરા	complete	પૂર્ણ	पूर्ण	poorn
7	નરમ	Soft	નરમ	नरम	naram
8	નવા	New	નવી	नवी	navee
9	મહંગા	Expensive	ખર્ચાળ	खर्चाळ	kharchaal
10	ગીલા	Wet	ભીનું	भीनुं	bheenun
11	સૂખા	Dry	શુષ્ક / સુકું	शुष्क / सुकु	shushk / suku
12	કઠિન	Difficult	મુશ્કેલ	मुश्केल	mushkel
13	રંગીન	Colourful	રંગબેરંગી	रंगबेरंगी	rngaberngee
14	સાફ	Clean	ચોખ્ખો	चोख्खो	chokkhkho
15	પસીના	Sweat	પરસેવો	परसेवो	parasevo
16	પતલા	Thin	પાતળું	पातळुं	paatalun
17	મોટા	Fat	ચરબી / જાડા	चरबी / जाडा	charabee / jaada
18	વિશેષ	Special	ખાસ	खास	khaas
19	ગહરા	Deep	ઊંડો	ऊंडो	oondo
20	અચ્છા	Good	સારું	सारुं	saarun
21	બડા	Big	મોટું	मोटुं	motu
22	બહુત	Many	ઘણા	घणा	ghana
23	ભારી	Heavy	ભારે	भारे	bhaare
24	ખટ્ટા	Sour	ખાટા	खाटा	khaataa
25	આલસી	Lazy	આળસુ	आळसु	aalasu
26	સુંદર	Beautiful	સુંદર	सुंदर	sundar
27	ખુશ	Happy	ખુશ	खुश	khush

વિશેષણ Adjective

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	તેજ	Fast	ઝડપી	झड़पी	jhadapee
2	શાંત	Quiet	શાંત	शांत	shaant
3	પૂરા	complete	પૂર્ણ	पूर्ण	poorn
4	કડા	Hard	કઠણ	कठण	kathan
5	નરમ	Soft	નરમ	नरम	naram
6	નવા	New	નવી	नवी	navee
7	મહંગા	Expensive	ખર્ચાળ	खर्चाळ	kharchaal
8	સસ્તા	Cheap	સસ્તુ	सस्तु	sastu
9	ગીલા	Wet	ભીનું	भीनुं	bheenun
10	સૂખા	Dry	શુષ્ક	शुष्क	shushk
11	કઠિન	Difficult	મુશ્કેલ	मुश्केल	mushkel
12	રંગીન	Colourful	રંગબેરંગી	रंगबेरंगी	rngabernggee
13	સાફ	Clean	ચોખ્ખો	चोखखो	chokhkho
14	પસીના	Sweat	પરસેવો	परसेवो	parasevo
15	પતલા	Thin	પાતળું	पातळुं	paatalun
16	મોટા	Fat	ચરબી / જાડા	चरबी / जाडा	charabee / jaada
17	વિશેષ	Special	ખાસ	खास	khaas
18	ગહરા	Deep	ઊંડો	ऊंडो	oondo
19	અચ્છા	Good	સારું	सारुं	saarun
20	બડા	Big	મોટું	मोटुं	motu
21	બહુત	Many	ઘણા	घणा	ghana
22	પુરાના	Old	જૂનું	जूनुं	joonun
23	ભારી	Heavy	ભારે	भारे	bhaare
24	ખટ્ટા	Sour	ખાટા	खाटा	khaataa
25	બહુત	Many	ઘણા	घणा	ghana
26	સુંદર	Beautiful	સુંદર	सुंदर	sundar

શારીરિક ક્રિયાएं Bodily Functions

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
	મુસ્કુરાના	Smiling	હસતા	હસતા	Hasataa
	શ્વસન ક્રિયા	Respiration	શ્વસન	શ્વસન	shvasan
	પાચન ક્રિયા	Digestion	પાચન	પાચન	paachan
	રક્ત સંચરણ	Blood Circulation	રક્ત પરિભ્રમણ	રક્ત પરિભ્રમણ	rakt paribhraman
	અવશોષણ ક્રિયા	Absorption	શોષણ	શોષણ	shoshan
	સંચરણ	Movement	હલનચલન	હલનચલન	halanchalan
	સોચના	Thinking	વચિારતા	વિચારતા	vichaarataa
	સોના	Sleeping	ઊંઘમાં	ઊંઘમાં	oonghamaan
	સુના	Hearing	સુનાવણી	સુનાવણી	sunaavanee
	બોલના	Speaking	બોલતા	બોલતા	bolataa
	અનુક્રિયા	Responsiveness	પ્રતિભાવ	પ્રતિભાવ	pratibhaav
	રોના	Weeping	રડવું	રડવું	radavun
	ચબાના	Chewing	ચાવવું	ચાવવું	chaavavun
	સ્પર્શ કરના	Touching	સ્પર્શવું	સ્પર્શવું	sparshvun
	નિગલના	Swallowing	ગળી જવું	ગળી જવું	galee javun
	દેખના	Seeing	જોઈને	જોઈને	joiine
	પકડના	Holding	પકડીને	પકડીને	pakadeene
	દોડના	Running	દોડી રહી છે	દોડી રહી છે	Dodi rahee chhe
	રેંગના	Crawling	ઘસડતાં	ઘસડતાં	ghasadataan
	ઉઠના	Stand up	ઉભા થાઓ	ઉભા થાઓ	ubhaa thaao
	જાગના	Wake up	ઉઠો	ઉઠો	utho
	બેઠના	Sitting	બેસવું	બેસવું	besavun
	કરવટ	Side	બાજુ	બાજુ	baaju
	સિર હિલાના	Nutate / Nid nod	માથું હલાવી	માથું હલાવી	maathun halaavee
	સૂંઘના	Sniff	સૂંઘવું	સૂંઘવું	sunghavun
	ઝપકી લેના	Napping	નિદ્રા / ઝોંકુ	નિદ્રા / ઝોંકુ	nidraa/jhonku

**ફલ FRUITs**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	કેલા	Banana	કેળા	કેલા	Kelaa
2	સંતરા	Orange	નારંગી	નારંગી	naarngee
3	લીચી	Litchi	લીચી	લીચી	leechee
4	અંગૂર	Grapes	દ્રાક્ષ	દ્રાક્ષ	draaksh
5	અમરૂદ	Guava	જામફળ	જામફલ	jaamafal
6	અનાર	Pomegranate	દાડમ	દાડમ	daadam
7	શરીફા સીતાફલ	Custurd apple	સીતાફળ	સીતાફલ	seetaafal
8	સેબ	Apple	સફરજન	સફરજન	safarajan
9	અનાનાસ	Pineapple	અનાનસ	અનાનસ	ananaas
10	પપીતા	Papaya	પપૈયા	પપૈયા	papaiyaa
11	મૌસમી	Grape fruit	મૌસંબી	મૌસંબી	mausnbee
12	આડૂ	Peach	આલુ	આલુ	aalu
13	કટહલ	Jack fruit	ફણસ	ફણસ	fanas
14	શહતૂત	Mullberry	શેતૂર	શેતૂર	shetoor
15	સ્ટ્રાબેરી	Strawberry	સ્ટ્રોબેરી	સ્ટ્રોબેરી	stroberee
16	ચીકૂ	Chickoo	ચિકૂ	ચિકૂ	chikoo
17	આમ	Mango	કેરી	કેરી	keree
18	ખરબૂજા	Melon	સક્કરટેટી	સક્કરટેટી	sakkaratetee
19	તરબૂજા	Water Melon	તરબૂચ	તરબૂચ	tarabooch
20	ખજૂર	Date Palm	ખજૂર	ખજૂર	khajoor
21	જામુન	Java Palm	જાંબુ	જાંબુ	jaanbu

સબ્જિયાં Vegetables

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ચુકંદર	Beetroot	બીટ	बीट	Beet
2	કરેલા	Bitter gourd	કારેલા	कारेला	kaarelaa
3	ટમાટર	TOMATO	ટામેટા	टामेटा	taametaa
4	ફૂલગોબી	Cauliflower	ફુલેવર	फुलेवर	fulevar
5	પ્યાજ	onion	ડુંગળી	डुंगळी	dungalee
6	બૈગન	Brinjal	રીંગણ	रींगण	reengan
7	હરીમટર	Greenpeas	લીલા વટાણા	लीला वटाणा	leelaa vataana
8	સલગમ	Turnip	સલગમ	सलगम	salagam
9	ગાજર	carrot	ગાજર	गाजर	gaajar
10	આલૂ	potato	બટાકા	बटाका	bataakaa
11	સેમફલી	Beans	દાણા	दाणा	daana
12	લોકી	Bottle guard	દૂધી	दूधी	doodhee
13	પત્તાગોબી	cabbage	કોબી	कोबी	kobee
14	ભિન્ડી	Ladies finger	ભીંડા	भींडा	bheenda
15	કદદૂ	pumpkin	કોળું	कोळुं	kolun
16	મૂલી	radish	મૂળો	मूळो	moolo
17	પાલક	spinach	પાલક	पालक	paalak
18	લહસુન	gralic	લસણ	लसण	lasan
19	તોરઈ	Ridyegaurd	તૂરિયું	तूरियुं	tooriyun
20	ખુમ્બ	Mashroom	મશરૂમ	मशरूम	masharoom
21	અરબી	Colocasia	અળવી	अळवी	alavee
22	શિમલા મિર્ચ	Capsicum	સમિલા મરિચી	सिमला मिर्ची	simalaa mirchee
23	ટિંડા	Tinda	ટિંડોરા	टिंडोरा	teendora
24	હરા ધનિયા	Coriander Leaves	કોથમીર/ લીલા ધાણા	कोथमीर/ लीला धाणा	kothameer / leelaa dhaana
25	નીબૂ	lemon	લીંબુ	लींबु	leenbu
26	હરી મિર્ચ	Green Chilli	લીલા મરચા	लीला मरचा	leelaa maracha

અન્ન / દલહન Foodgrains / Pulses

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	गेहूँ	WHEAT	ઘઉં	घउं	Ghaun
2	चावल / धान	RICE	ચોખા	चोखा	chokhaa
3	मक्का	MAIZE	મકાઈ	मकाई	makaaii
4	बाजरा	MILLET	બાજરી	बाजरी	baajaree
5	ज्वार	SORGHUM	જુવાર	जुवार	juvaar
6	जौ	BARLY	જવ	जव	jav
7	चना	BLACK GRAM	ચણા	चना	chana
8	साबूदाना	SAGO	સાબુ દાણાં	साबु दाणां	saabu daanan
9	जई	OATS	ઓટ્સ	ओट्स	ots
10	रागी	RAGI	રાગી	रागी	raagee
11	कुटकी	LITTLE MILLET	કોદરી	कोदरी	kodaree
12	कुटहू	BUCKWHEAT	બિયાં સાથેનો દાણો	बियां साथेनो दाणो	biyaan saatheno daano
13	समा चावल	BARNYARD MILLET	રાજગરો	राजगरो	raajagaro
14	सेला चावल	PARBOILD RICE	બોઇલ ચોખા	बोइल चोखा	boil chokhaa
15	भूरा चावल	BROWN RICE	બ્રાઉન રાઇસ	ब्राउन राइस	braaun raais
16	दलिया	BROKEN WHEAT	તૂટેલા ઘઉં	तूटेला घउं	tootelaa ghaun
17	पोहा / चवडा	RICE FLAKES	ચોખાના ટુકડા / કણકી	चोखाना टुकडा / कणकी	chokhaanaa tukada / kanakee
18	मुरमुरा	RICE PUFFED	મમરા	ममरा	mamaraa
19	सूजी रवा	SEMOLINA	રવો	रवो	Ravo
20	मसूर	RED LENTIL	લાલ મસૂર	लाल मसूर	laal masoor
21	काबुली चना	Chickpea	કાબુલી ચણા	काबुली चना	kaabulee chana
22	अरहर	PIGEON PEA	તુવેર	तुवेर	tuver
23	मूंग	GREEN Pulse	મગ	मग	mag
24	मटर	Pea	વટાણા	वटाणा	vataana
25	काली उडद	BLACK GRAM	કાળી અડદ	काळी अडद	kaalee adad
26	कुलथी की दाल	HORSE GRAM	ચણા ની દાળ	चना नी दाल	chana nee daal
27	लोबिया	COWPEA	વાલ / ચોરા	वाल / चोरा	vaal / choraa
28	राजमा	KIDNEY BEANS	રાજમા	राजमा	raajamaa

तेल Oils

क्रम	हिन्दी	अँग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	सरसों का तेल	MUSTARD OIL	सरसवनुं तेल	सरसवनुं तेल	Sarasavanun tel
2	मूंगफली का तेल	PEANUT OIL	मगइणीनुं तेल	मगफळीनुं तेल	magafaleenun tel
3	सूरजमुखी का तेल	Sunflower OIL	सूर्यमुष्ठी तेल	सूर्यमुखी तेल	sooryamukhee tel
4	जैतून का तेल	Olive OIL	ओववि तेल	ओलिव तेल	oliv tel
5	सोयाबीन का तेल	Soyabean OIL	सोया बीन तेल	सोया बीन तेल	soyaa been tel
6	नारयिल का तेल	COCONUT OIL	नाणथिर तेल	नाळियेर तेल	naaliyer tel
7	तलि का तेल	SESAME OIL	तल नुं तेल	तल नुं तेल	tal nun tel
8	अरंडी का तेल	CASTOR OIL	दिविल	दिवेल	divel
9	अलसी का तेल	EIAX SEED OIL	अलसीनुं तेल	अळसीनुं तेल	alaseenun tel
10	मक्का का तेल	CORN OIL	मकाईनुं तेल	मकाईनुं तेल	makaaiinun tel
11	लौग का तेल	CLOVE OIL	लवंगि तेल	लविंग तेल	laving tel
12	नीम तेल	MARGOSA OIL	लीमडानुं तेल	लीमडानुं तेल	leemadanun tel
13	कपूर का तेल	CAMPHOR OIL	कपूर तेल	कपूर तेल	kapoor tel
14	कुसुम तेल	SAFFIOWER OIL	कुसुम तेल	कुसुम तेल	kusum tel
15	चावल की भूसी का तेल	RICE BRAN OIL	चोष्ठा ब्रान तेल	चोष्ठा ब्रान तेल	chokhaa braan tel
16	तुलसी का तेल	BASIL OIL	तुलसीनो छोड तेल	तुलसीनो छोड तेल	tulaseeno chhod tel
17	बादाम का तेल	ALMOND OIL	बदाम तेल	बदाम तेल	badaam tel
18	गुलाब का तेल	ROSE OIL	गुलाब तेल	गुलाब तेल	gulaab tel
19	चंदन का तेल	SANDALWOOD OIL	चंदन तेल	चंदन तेल	chndan tel

મસાલે Spices

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	રતન જોત	Dyers Alkanet	રતન જોત	રતન જોત	ratan jot
2	જાવિત્રી	Mace	જાવંત્રી	જાવંત્રી	jaavntree
3	હલ્દી ચૂર્ણ	Turmeric Powder	હળદર પાવડર	હલ્દર પાવડર	haladar paavadar
4	જીરા	Cumin	જીરું	જીરું	jeerun
5	અજવાયન	Oregano	અજમો	અજમો	ajamo
6	હીંગ	Asafoetida	હીંગ	હીંગ	heeng
7	મુલેઠી	Liquorice	મુલેતી	મુલેતી	muletee
8	ગોંદ	Frankincense	ગુંદર	ગુંદર	gundar
9	ખસખસ	Poppy Seeds	ખસખસ	ખસખસ	khasakhas
10	નમક	Salt	મીઠું	મીઠું	meethun
11	સેંધા નમક	Rock Salt	સધિલુણ	સિન્ધાલૂણ	Sindhagoon
12	કાલા નમક	Black Salt	સંચળ	સંચલ	sanchal
13	કાલી મિર્ચ	Black Pepar	કાળા મરી	કાલા મરી	kaalaa maree
14	લાલ મિર્ચ	Red Chilli	લાલ મરચું	લાલ મરચું	laal marachun
15	પીપલ	Long Pepper	પીપર	પીપર	peepar
16	કેસર	Saffron	કેસર	કેસર	kesar
17	અમચૂર	Mango Powder	આમચુર / કેરી નો પાઉડર	આમચુર / કેરી નો પાઉડર	aamachur / keree no paaudar
18	રાઈ	Mustard Seeds	રાઈ	રાઈ	raaii
19	સૌંઠ	Dry Ginger	સુંઠ	સુંઠ	sunth
20	લહસુન	Garlic	લસણ	લસણ	lasan
21	અદરક	Ginger	આદું	આદું	aadun
22	મેંથી	Fenugreek	મેથી	મેથી	methee
23	દાલચીની	Cinnamon	તજ	તજ	taj



**મેવા Dryfruits**

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	અખરોટ	Walnut	અખરોટ	અખરોટ	akharot
2	બાદામ	Almond	બદામ	બદામ	badaam
3	કાજૂ	Cashew Nut	કાજુ	કાજુ	kaaju
4	પિસ્તા	Pistachio	પિસ્તા	પિસ્તા	pistaa
5	કિશમિશ	Raisins	કસિમસિ	કિસમિસ	kisamis
6	અંજીર	Fig	અંજીર	અંજીર	anjeer
7	મખાના	Fox nuts / Lotus seeds pop	મખાના	મખાના	makhaanaa
8	ચિરૌંજી	Cudpah nut / Pistachio soft	પિસ્તા	પિસ્તા	pistaa
9	મુનક્કા	Dry Grapes / Raisins	સુકી દ્રાક્ષ	સુકી દ્રાક્ષ	sukee draaksh
10	સૂખા નારિયલ/ખોપરા	Desiccated Coconut	સૂકું નાળયિર/કોપરા	સૂકું નાળયિર/કોપરા	sookun naaliyer/koparaa
11	ખજૂર	Dates	ખજૂર	ખજૂર	khajoor
12	છુહારે	Dry Dates	ખારેક	ખારેક	khaarek
13	ખુબાની	Apricot	જરદાળુ	જરદાળુ	jaradaalu
14	નીલબદરી	Blueberry	બ્લુબેરી	બ્લુબેરી	bluberee
15	શાહબલૂત	Chestnut	જંગલી બોર	જંગલી બોર	jngalee bonr
16	ચિલગોજા	Pine Nuts	ચલિગોઝા	ચિલગોઝા	chilagojhaa

**रसोई के सामान Kitchen wares**

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	टोकरी	Basket	टोपवी	टोपली	topalee
2	डिब्बा	Box / Container	बोक्स	बोक्स	boks
3	चिमनी	Chimney	चीमनी	चीमनी	cheemane
4	मथनी	Churner	मंथन	मंथन	manthan
5	चूल्हा	Stove	चूलो / स्टोव	चूलो / स्टोव	Chulo/stove
6	मर्तबान	Jar	जार / बरणी	जार / बरणी	jaar / baranee
7	बरतन / बर्तन	Utensils	वासणो	वासणो	vaasano
8	सरौता	Nut cracker	सूडी	सूडी	soodee
9	तन्दूर	Oven	तंदूर	तंदूर	tndoor
10	कड़ाही	pan	कडाई	कडाई	kadaii
11	चकला	Pastry-board	पाटयु	पाटियुं	paatiyun
12	मूसल	Pestle	मुसली	मुसली	musalee
13	सँडसी (चिमटी)	Pincers	चीपयि	चीपियो	cheepiyo
14	थाली	Plate / Dish	थाणी	थाळी	thaaalee
15	बेलन	Rolling pin	वेलण	वेलण	velan
16	तश्तरी	Saucer	रकाबी	रकाबी	rakaabee
17	चलनी, छलनी	Sieve	चायनी	चायनी	chaayanee
18	चम्मच, चमचा	Spoon	चमची, चमची	चमची, चमची	chamachee, chamachee
19	जल शोधक यंत्र	water purifier	पाणी शुद्धिकरण	पाणी शुद्धिकरण	paanee shuddhikaran
20	चिमटा	Tong	साणसी	साणसी	saanasee
21	बोटल	Bottle	बोटल	बोटल	botal
22	कटोरा	Bowl	वाटकी	वाटकी	vaatakee
23	लोटा	Bowl	लोटे	लोटे	loto
24	कांटा	Fork	कांटे	कांटे	kaanto
25	प्याला	Cup	प्यालो	प्यालो	pyaalo

**ઘર કે સામાન Household Items**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ઘડી	Clock	ઘડિયાળ	ઘડિયાळ	ghadiyaal
2	સંગણક	computer	કમ્પ્યુટર	કમ્પ્યુટર	kampyutar
3	પંખા	fan	પંખો	પંખો	pnkho
4	ઈસ્ત્રી, પ્રેસ	Iron	ઈસ્ત્રી,	ઈસ્ત્રી,	istree,
5	કુંજી, ચાબી	Key	ચાવી, ચાવી	ચાવી, ચાવી	chaavee, chaavee
6	સલાઈ	Knitting needle	સોય	સોય	soy
7	ચિરાગ	Lamp	દીવો	દીવો	deevo
8	ચટાઈ	Mat	સાદડી	સાદડી	saadadee
9	દર્પણ, આઈના	Mirror	અરીસો	અરીસો	areeso
10	સુઈ	Needle	સોય	સોય	soy
11	થેલા	Sack	થેલી	થેલી	thelee
12	સિલાઈ મશીન	sewing machine	સીલાઈ મશીન	સીલાઈ મશીન	seelaai masheen
13	ચાદર	Sheet	ચાદર	ચાદર	chaadar
14	સાબુનદાની	Soap-case	સાબુ દાની	સાબુ દાની	saabu daanee
15	સુખાને વાલા	Spin Dryer	સુકા	સુકા	sukaa
16	ઝૂલા	Swing	હિંચકો	હિંચકો	hinchako
17	છાતા, છત્રી	Umbrella	છત્રી	છત્રી	chhatree
18	તરાજૂ	Balance	ત્રાજવું	ત્રાજવું	traajavun
19	ખિડકી	window	બારી	બારી	baaree
20	કંઘી	Comb	કાંસકો	કાંસકો	kaansako
21	દન્ત મંજન	Toothpowder	ટૂથપેસ્ટ	ટૂથપેસ્ટ	toothapest
22	તોલિયા	Towel	ટુવાલ	ટુવાલ	tuvaal
23	ઝાડૂ	Broom	સાવરણી	સાવરણી	saavaranee
24	બોતલ	Bottle	બોટલ	બોટલ	botal
25	બાલ્ટી	Bucket	ડોલ	ડોલ	dol
26	બટન	Button	બટન	બટન	batan
27	કંબલ	Blanket	ધાબળો	ધાબળો	dhaabalo
28	પાયદાન	Door-mat	પગ લુછણિયું	પગ લુછણિયું	pag luchhaniyun

फर्नीचर Furniture.

क्रम	हिन्दी	अँग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	अलमारी	Almirah/ Cupboard	तजिरी	तिजोरी	tijoree
2	पलंग / बिस्तर	Bed	पथारी / पथारी	पथारी / पथारी	pathaaree / pathaaree
3	कालीन	Carpet	सादडी	सादडी	saadadee
4	कुर्सी	Chair	खुरशी	खुरशी	khurashee
5	चारपाई, खाट	Cot	खाटलो	खाटलो	khatalo
6	मेज़	Desk / Table	टेबल	टेबल	tebal
7	खाने की मेज	dining table	डाइनगि टेबल	डाइनिंग टेबल	daining tebal
8	डबल बेड	Double Bed	डबल बेड	डबल बेड	dabal bed
9	श्रृंगार पटल	Dressing Table	ड्रेसिंग टेबल	ड्रेसिंग टेबल	dresing tebal
10	फाइलें रखने की अलमारी	Filing Cabinet	फाइल डेबनिट	फाइल केबिनेट	faail kebinet
11	रसोई अलमारियाँ	kitchen cabinets	रसोडुं घर	रसोडुं घर	rasodun ghar
12	चटाई	Mat	सादडी	सादडी	saadadee
13	गद्दा	Mattress	गादलुं	गादलुं	gaadalun
14	दर्पण, आईना	Mirror	अरीसो/ अरीसो	अरीसो/ अरीसो	areeso/ areeso
15	तकिया	Pillow / Cushion	ओशीकुं	ओशीकुं	osheekun
16	तकिये का आवरण	Pillow-cover	ओशीकुं कवर	ओशीकुं कवर	osheekun kavar
17	तिजोरी	Safe	तजिरी	तिजोरी	tijoree
18	चादर	Sheet	शीट	शीट	sheet
19	सोफ़ा	Sofa	सोफ़ा	सोफ़ा	sofaa
20	सोफ़ा बेड	Sofa-Bed	सोफ़ा बेड	सोफ़ा बेड	sofaa bed
21	स्टूल	Stool	नानुं टेबल	नानुं टेबल	naanun tebal
22	झूला	Swing	हिनचको	हिनचको	hinchako
23	वस्त्र टांगने की अलमारी	Wardrobe	कपडा नुं कबाट	कपडा नुं कबाट	kapada nun kabaat
24	बिस्तर	bed	पथारी	पथारी	pathaaree
25	पर्दे	Curtains	पडदा	पडदा	padadaa
26	किताबों की अलमारी	Bookcase	चोपडीओनुं कबाट	चोपडीओनुं कबाट	chopadeeonun kabaat

**ऋतुएँ Seasons**

ક્રમ	હિન્દી	ઁગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	બંસત	Spring	વસંત	વસંત	Vasnt
2	ગ્રીષ્મ	Summer	ઉનાળો	ઉનાલો	unaalo
3	વર્ષા	Rainy	વરસાદ	વરસાદ	varasaad
4	શરદ	Winter	પાનખર	પાનખર	paanakhar
5	હેમંત	Frost	હેમંત	હેમંત	hemnt
6	શિશિર	Autumn	શશિરિ	શિશિર	shishir
7	બારિસ	Rain	વરસાદ	વરસાદ	varasaad
8	વર્ફ	Snow	બરફ	બરફ	baraf
9	બાદલ	Cloud	વાદળ	વાદલ	vaadal
10	કુહાસા	Fog	ઝાકળ	ઝાકલ	jhaakal
11	બાઢ	Flood	પૂર	પૂર	poor
12	સૂઝા	Drought	દુકાળ / અનાવૃષ્ટિ	દુકાલ / અનાવૃષ્ટિ	dukaal / anaavrishti
13	માનસૂન	Monsoon	ચોમાસું	ચોમાસું	chomaasun
14	ઋતુએ	Seasons	ઋતુઓ	ઋતુઓ	rrituo
15	શુષ્ક	Dryness	શુષ્ક	શુષ્ક	shushk
16	આર્દ્રતા	Humidity	ભેજ	ભેજ	bhej
17	નમી	Moisture	ભેજ	ભેજ	bhej
18	સૂર્યોદય	Sunrise	સૂર્યોદય	સૂર્યોદય	sooryoday
19	સૂર્યાસ્ત	Sunset	સૂર્યાસ્ત	સૂર્યાસ્ત	sooryaast
20	ચક્રવાત	Cyclone	ચક્રવાત	ચક્રવાત	chakravaat
21	બિજલી	Lightning	વીજળી	વીજલ્લી	veejalee
22	તૂફાન	Storm	તોફાન	તોફાન	tofaan
23	બૂંદાબાંદી / ફુહાર	Dazzle	ઝરમર વરસાદ	ઝરમર વરસાદ	jharamar varasaad
24	બર્ફબારી	Snowfall	હિમવર્ષા	હિમવર્ષા	himavarshaa
25	ઓલાવૃષ્ટિ	Hail	અતિવૃષ્ટિ	અતિવૃષ્ટિ	ativrishti
26	પતઝડ	Fall	પાનખર	પાનખર	paanakhar
27	આંધી તૂફાન	Thunder storm	વાવાઝોડું	વાવાઝોડું	vaavaajhodun

વેષભૂષા / પરિધાન Dresses

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	જીન્સ	Jeans	જીન્સ	જીન્સ	Jeens
2	દુપટ્ટે	Scarf	દુપટ્ટા	દુપટ્ટા	dupattaa
3	ઘાઘરા	Skirt	ઘાઘરા	ઘાઘરા	ghaagaraa
4	સાડી	Saree	સાડી	સાડી	saaḍaaee
5	ટોપી	Cap / Hat	કેપ / ટોપી	કેપ / ટોપી	kep / ṭopee
6	પતલૂન / પેન્ટ	Trousers / Pant	ટ્રાઉઝર / પેન્ટ	ટ્રાઉઝર / પેન્ટ	ṭraaujhar/ pent
7	નિકર	Half - Pant	શોર્ટ્સ	શોર્ટ્સ	shorts
8	પાઘડી, સાફા	Turban	પાઘડી, સાફા	પાઘડી, સાફા	paaghadaee, saafaa
9	ફ્રૉક	Frock	ફ્રોક	ફ્રોક	frok
10	લહંગા	Long Skirt	લેંઘો	લેંઘો	lengho
11	સ્વેટર	Pullover / Sweater	સ્વેટર	સ્વેટર	svetar
12	ધોતી	Dhoti	ધોતી	ધોતી	dhotee
13	જર્સી	Jersey	જર્સી	જર્સી	jarsee
14	ટી શર્ટ	T-shirt	ટી-શર્ટ	ટી-શર્ટ	tee-shart
15	બનયાન	Vest	બંડી	બંડી	bnḍaaee
16	કોટ	Coat	કોટ	કોટ	koṭ
17	કચ્છા	Knickers	ચડ્ડી	ચડ્ડી	chadaḍaaee
18	બ્લાઉઝ	Blouse	બ્લાઉઝ	બ્લાઉઝ	blaaujh
19	ટ્રૅક સૂટ	Tracksuit	ટ્રેક સૂટ	ટ્રેક સૂટ	ṭrek sooṭ
20	બરસાતી	Raincoat	રેઇનકોટ	રેઇનકોટ	reiinakooṭ
21	ટાઈ	Tie	ટાઈ	ટાઈ	ṭaaii
22	નાઈટી	Nighty	નાઈટી	નાઈટી	naaiṭee
23	લુંગી	Lungi	લુંગી	લુંગી	lungee
24	કમીઝ	Shirt	શર્ટ	શર્ટ	shart
25	પાજામા	Pyjama	પાયજામા	પાયજામા	paayajaamaa

પાલતૂ પશુ Pet animals.

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ગાય	COW	ગાય	ગાય	gaay
2	બૈલ	OX	બળદ	બલદ	balad
3	ભૈસ	BUFFALO	ભૈસ	ભૈસ	bhens
4	કુત્તા	DOG	કૂતરો	કૂતરો	kootaro
5	બિલ્લી	CAT	બલાડી	બિલાડી	bilaadee
6	ઁન્ટ	CAMEL	ઁન્ટ	ઁન્ટ	oont
7	ઘોડા	HORSE	ઘોડો	ઘોડો	ghodo
8	બકરી	GOAT	બકરી	બકરી	bakaree
9	બન્દર /વાનર	MONKEY /Ape	વાનર	વાનર	vaanar
10	લંગૂર	LAP	લંગૂર	લંગૂર	lngoor
11	હાથી	ELEPHANT	હાથી	હાથી	haathee
12	ખચ્ચર	MULE	ખચ્ચર	ખચ્ચર	khachchar
13	સુઅર	PIG	ડુકકર/ભૂંડ	ડુકકર/ભૂંડ	dukkar/ bhoond
14	ભેડ	SHEEP	ઘેટાં	ઘેટાં	ghetaan
15	ભેડ	EWE	ઘેટાં	ઘેટાં	ghetaan
16	ગધા	ASS / Donkey	ગધેડો	ગધેડો	gadhedo
17	ટટ્ટૂ	PONY	ટટ્ટૂ	ટટ્ટૂ	tattu
18	ભેડ	RAM	ઘેટાં	ઘેટાં	ghetaan
19	ગિલહરી	SQUIRREL	ખસિકોલી	ખસિકોલી	khisakolee

**જંગલી પશુ Wild animals**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ભાલૂ	BEAR	રીછ	રીછ	reenchh
2	ગેંડા	RHINOCEROS	ગેંડા	ગેંડા	genda
3	સાંડ	BULL	બળદ	બલદ	balad
4	હાથી	ELEPHANT	હાથી	હાથી	haathee
5	લોમડી	FOX	શયાળ	શિયાલ	shiyaal
6	લકડબઘા	HYENA	લકડખોદ	લકકડખોદ	lakkadakhod
7	સુઅર	PIG	ડુકકર / ભૂંડ	ડુકકર / ભૂંડ	dukkar/ bhoond
8	ખરગોશ	RABBIT	સસલું	સસલું	sasalun
9	બાઘ	TIGER	વાઘ	વાઘ	vaagh
10	જેબરા	ZEBRA	ઝેબ્રા	ઝેબ્રા	jhebraa
11	ભેડિયા	WOLF	વરુ	વરુ	varu
12	બારહસિંગા	STAGE	શીત પ્રદેશનું હરણ / બારસિંગા	શીત પ્રદેશનું હરણ / બારસિંગા	sheet pradeshnanun haran / baarasingaa
13	તેંદુઆ	PANTHER	ચિત્તો	ચિત્તો	chitto
14	હિરન	DEER	હરણ	હરણ	haran
15	નેવલા	MONGOOSE	મંગૂસ	મંગૂસ	mngoos
16	સિંહ / શેર	LION	સહિ / સહિ	સિંહ / સિંહ	sinh / sinh
17	તેંદુઆ	LEOPARD	ચિત્તો	ચિત્તો	chitto
18	સિયાર	JACKAL	શયાળ	શિયાલ	shiyaal
19	કંગારૂ	KANGAROO	કાંગારૂ	કાંગારૂ	kaangaaroo
20	જિરાફ	GIRAFFE	જિરાફ	જિરાફ	jiraaf
21	ચિમ્પેંઝી	CHIMPANZEE	ચિમ્પાન્ઝી	ચિમ્પાન્ઝી	chimpanjee
22	સાહી	PORCUPINE	શાહુડી	શાહુડી	shaahudee
23	જંગલી સુઅર	BOAR	જંગલી ડુકકર	જંગલી ડુકકર	jngalee dukkar
24	જંગલી ભેંસા	BISON	જંગલી ભેંસ	જંગલી ભેંસ	jngalee bhens



ફૂલ / પૌધે / વૃક્ષ કે નામ Flowers / Plants / Trees

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	તુલસી	TULSI, BASIL	તુલસી	તુલસી	tulasee
2	નીમ	NEEM	લીમડાનું ઝાડ	લીમડાનું ઝાડ	leemadanun jhaad
3	રૂદ્રાક્ષ	ELAEOCARPUS	રૂદ્રાક્ષ	રૂદ્રાક્ષ	roodraaksh
4	ઘૃતકુમારી, ઈલોવેરા	ALOE-VERA	એલોવેરા	એલોવેરા	eloveraa
5	ગુડહલ	HIBISCUS PLANT	હિબિસ્કસ	હિબિસ્કસ	hibiskas
6	ધનિયા	CORRIANDER	ધાણા	ધાણા	dhaana
7	પુદીના	MINT, MENTHA	ફૂદીનો	ફૂદીનો	foodeeno
8	કઢી પત્તા / મીઠા નીમ	CURRY PLANT	કઢી પત્તા / મીઠો લીમડો	કઢી પત્તા / મીઠો લીમડો	kaḍhee patta / meetho leemado
9	સૂરજમુખી	SUNFLOWER	સૂર્યમુખી	સૂર્યમુખી	sooryamukhee
10	સદાબહાર	EVERGREEN	સદાબહાર	સદાબહાર	sadaabahaar
11	ગુલાબ	ROSE	ગુલાબ	ગુલાબ	gulaab
12	ચમેલી	JASMINE	જાસ્મીન	જાસ્મીન	jaasmeen
13	કમલ	LOTUS	કમળ	કમલ	kamal
14	ગેંદા	Mari gold	મેરીગોલ્ડ	મેરીગોલ્ડ	mereegold
15	સેવંતી / ગુલદાવરી	CHRYSANTHEMUM	સેવંતી / ક્રાયસનથેમમ	સેવંતી / ક્રાયસનથેમમ	sevntee / kraayasanthemam
16	ચંપા	MAGNOLIA	ચંપા	ચંપા	chnpaa
17	મોગરા	JASMINE SAMBAC	મોગરા	મોગરા	mogaraa
18	જૂહી	SWEET JASMINE	જુહી	જુહી	juhee
19	બેલા	ARABIAN JASMINE	વાંસળી	વાંસળી	vaansalee
20	કનેર	OLEANDER	કનેર	કનેર	kaner
21	કુમુદિની	LILY FLOWER	લીલી	લીલી	leelee
22	ચાંદની	CRAPE JASMINE	મૂનલાઇટ	મૂનલાઇટ	moonalaait
23	અપરાજિતા	Butterfly pea	અપરાજિતા	અપરાજિતા	aparaajitaa
24	બબૂલ	Acacia	બબૂલ	બબૂલ	babool
25	ચંદન	Sandal	ચંદન	ચંદન	chndan
26	શીશમ	Rosewood	રોઝવુડ / શિસમ	રોઝવુડ / શિસમ	rojhavud /shisam
27	બરગદ	Banyan	બરગડ	બરગડ	baragad
28	પીપલ	Ficus religiosa	પીપલ	પીપલ	peepal

યાત્રા સંબંધી શબ્દ Travel words

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	યાત્રા	Travel / Tour	પ્રવાસ	પ્રવાસ	pravaas
2	પર્યટન	Tourism	પ્રવાસન	પ્રવાસન	pravaasan
3	ઝરીદારી	Shopping	ખરીદી	ખરીદી	khareedee
4	હવાઈ જહાજ	Airopplane	વિમાન	વિમાન	vimaan
5	બસ	Bus	બસ	બસ	Bas
6	રેલ	Railway	રેલ	રેલ	rel
7	જલયાન/પાની કા જહાજ	Ship	વહાણ	વહાણ	vahaan
8	ટિકટ	Ticket	ટિકિટ	ટિકિટ	tikit
9	સામાન	Luggage	સામાન	સામાન	saamaan
10	કુલી	Coolie	મજૂર	મજૂર	majoor
11	પર્યટક	Tourist	પ્રવાસી	પ્રવાસી	pravaasee
12	જગહ, સ્થાન	Places	જગ્યા	જગ્યા	jagyaa
13	ઐતિહાસિક સ્થાન	Historical Places	ઐતિહાસિક સ્થળો	ઐતિહાસિક સ્થળો	aitihaasik sthalo
14	આરક્ષણ	Booking	આરક્ષણ	આરક્ષણ	arakshan
15	દર્શનીય સ્થલ	Sight Seeing	દર્શનીય સ્થળો	દર્શનીય સ્થળો	darshaneey sthalo
16	યાત્રી, પર્યટક	Traveler	પ્રવાસી,	પ્રવાસી	pravaasee,
17	પર્વત	Mountain	પર્વત	પર્વત	parvat
18	બગીચા, ઉદ્યાન	Garden / Park	બગીચો	બગીચો	bageecho
19	જંગલ	Jungle	વન	વન	van
20	સમુદ્રતટ	Sea Shore	સમુદ્ર કિનારો	સમુદ્ર કિનારો	samudr kinaaro
21	વિદેશ યાત્રા	Foreign Tour	વિદેશ પ્રવાસ	વિદેશ પ્રવાસ	videsh pravaas
22	ચાલક	Driver	ડ્રાઈવર	ડ્રાઈવર	draaiivar
23	દુભાષી	Interpreter	દુભાષિયા	દુભાષિયા	dubhaashiyaa
24	માર્ગદર્શક	Guide	માર્ગદર્શક	માર્ગદર્શક	maargadarshak
25	આગમન	Arrival	આગમન	આગમન	aagaman
26	પ્રસ્થાન	Departure	પ્રસ્થાન / શુરુઆત	પ્રસ્થાન / શુરુઆત	prasthaan / shuruaat
27	ગંતવ્ય (સ્થાન)	Destination	ગંતવ્ય સ્થળ) / પહોંચવાનું સ્થળ	ગંતવ્ય સ્થળ) / પહોંચવાનું સ્થળ	gntavya sthal/ pahonchavaanun sthal

યાત્રા સંબંધી શબ્દ Travel words

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	પ્રથમ વર્ગ	First Class	પ્રથમ વર્ગ	પ્રથમ વર્ગ	pratham varg
2	દ્વિતીય વર્ગ	Second Class	બીજા વર્ગ	બીજા વર્ગ	beejaa varg
3	જલપાન ગૃહ	Canteen	રેસ્ટોરન્ટ	રેસ્ટોરન્ટ	restorant
4	સૂર્યાસ્ત કી જગહ	Sun Set Point	સૂર્યાસ્તનું સ્થળ	સૂર્યાસ્તનું સ્થલ	sooryaastanun sthal
5	સૂર્યોદય કી જગહ	Sun Rise Point	સૂર્યોદયની જગ્યા	સૂર્યોદયની જગ્યા	sooryodayanee jagyaa
6	રસોઈ બંડાર	Pantry	ફૂડ પેન્ટ્રી	ફૂડ પેન્ટ્રી	food pentree
7	પંક્ષી અભયારણ્ય	Bird Sanctuary	પક્ષી અભયારણ્ય	પક્ષી અભયારણ્ય	pakshee abhayaarany
8	વોટર પાર્ક	Water Park	જલ ઉદ્યાન	જલ ઉદ્યાન	jal udhaan
9	પ્રતીક્ષાલય	Waiting Room	પ્રતિક્ષા ખંડ	પ્રતિક્ષા ખંડ	pratikshaa khnd
10	પ્રથમોપચાર	First Aid	પ્રાથમિક સારવાર	પ્રાથમિક સારવાર	praathamik saaravaar
11	પ્રતીક્ષા સૂચી	Waiting List	પ્રતિક્ષા યાદી	પ્રતિક્ષા યાદી	prateekshaa yaadee
12	ઘડી	Watch	ઘડિયાળ	ઘડિયાલ	ghadiyaal
13	ઘોષણા	Announcement	જાહેરાત	જાહેરાત	jaaheraat
14	વિશ્રામ ગૃહ	Holiday Home	આરામ ગૃહ	આરામ ગૃહ	aaraam grih
15	પ્રવેશ પત્ર	Entry Pass	પ્રવેશ પત્ર	પ્રવેશ પત્ર	pravesh patr
16	પ્રવેશ-દ્વાર	Entrance	પ્રવેશ દ્વાર	પ્રવેશ દ્વાર	pravesh dvaar
17	અભયારણ્ય	Sanctuary	અભયારણ્ય	અભયારણ્ય	abhayaarany
18	નાશ્તા	Snack	નાસ્તો	નાસ્તો	naasto
19	શુદ્ધ હવા	Fresh Air	શુદ્ધ હવા	શુદ્ધ હવા	shuddh havaa
20	પ્રાકૃતિક સુંદરતા	Natural Scenery	કુદરતી સૌંદર્ય	કુદરતી સૌંદર્ય	kudaratee saundry

રંગ Colours

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	નીલા	Blue	વાદળી	વાદલી	vaadalee
2	લાલ	Red	લાલ	લાલ	laal
3	જામુની / ગહરા બૈગની	Purple	જાંબલી	જાંબલી	jaanbalee
4	પીલા	Yellow	પીળો	પીલો	peelo
5	ગુલાબી	Pink	ગુલાબી	ગુલાબી	gulaabee
6	હરા	Green	લીલા	લીલા	leelaa
7	નારંગી	Orange	નારંગી	નારંગી	naarngee
8	સફેદ	White	સફેદ	સફેદ	safed
9	કાલા	Black	કાળો	કાલો	kaalo
10	મટમૈલા	Grey	ભૂખરા	ભૂખરા	bhookharaa
11	ભૂરા	Brown	બ્રાઉન / બદામી	બ્રાઉન / બદામી	braaun / badaamee
12	નીલ રંગ	Indigo	નીલો	નીલો	neelo
13	મૈરૂન	Maroon	મરૂન	મરૂન	maroon
14	ગહરા નીલા	Navy Blue	નેવી બ્લુ	નેવી બ્લુ	nevee blu
15	સરસો રંગ	Mustard	સરસવ	સરસવ	sarasav
16	હલ્કા પીલા	Light Yellow	આછો પીળો	આછો પીલો	aachho peelo
17	જૈતૂન કા રંગ	Olive	ઓલિવ	ઓલિવ	oliv
18	બૈગની	Violet	વાયોલેટ	વાયોલેટ	vaayolet
19	ફરિંજા	Turquoise	પીરોજ / આસમાની	પીરોજ / આસમાની	peeroj / aasamaanee
20	મૂંગા રંગ	Coral	મૂંગા	મૂંગા	moongaa
21	નીલા હરા	Teal	લીલો	લીલો	leelo
22	ભૂરા પીલા રંગ	Amber	ભૂરો	ભૂરો	bhooro
23	સુનહરા	Golden	સુવર્ણ	સુવર્ણ	suvarn
24	ચાંદી જૈસા રંગ	Silver	ચાંદી	ચાંદી	chaandee
25	ધૂમલિ સફેદ	Off White	આછો સફેદ	આછો સફેદ	aachho safed
26	ધાતુમય રંગ	Metallic	મેટાલિક / ધાતુમાય	મેટાલિક / ધાતુમાય	metaalik / dhaatumaay

आभूषण Ornaments

क्रम	हलनुदी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	चूडी	Bangle	ढंगडी	ढंगडी	bngadee
2	अंगूठी	Ring	रगि / वीटी	रिंग / वींटी	ring /veentee
3	कंगन	Bracelet	ढंगडी	ढंगडी	bngadee
4	कर्णफूल	Ear ring	काननुं डूल / डुटी	काननुं फूल / डुटी	kaananun fool / buttee
5	नाक की बाली / लौंग	Nose pin	नाकनी डुटी / नथणी	नाकनी डुटी / नथणी	naaknee buttee / nathanee
6	हार	Necklaces	डार	हार	haar
7	पायल	Anklet	अंअर	अंअर	jhaanjhar
8	बाजूढंद	Armlet	डलथढंध / डलअडुढंध	डलथढंध / डलअडुढंध	haathabndh / baajubndh
9	अंगूठे कल छल्ला	Toe rings	अंगूठानी वीटी	अंगूठानी वींटी	angoothaanee veentee
10	कडरढंध	Waist let	कडरढंध	कडरढंध	kamarabndh
11	बालों कल कांटा	Hairpin	डेरपनि / डलथल नी पनि	डेरपनि / डलथल नी पनि	herapin / maathaa nee pin
12	डलंग टीकल	Head Locket	कडडलल डलंढलो	कडडलल डलंढलो	kapaal chaandalo
13	लोलक	Pendent	डोलक	लोलक	lolak
14	कांटा (सलडी कल)	Brooch	कलंटी (सलडीनो)	कलंटी (सलडीनो)	kaanto (saadeeno)
15	डुकुट	Tiara / Crown	तलअ	तलअ	taaj

## खेल Sports

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	બેડમિન્ટન	Badminton	બેડમિન્ટન / ફૂલ રેકકેટ	બેડમિન્ટન / ફૂલ રેકકેટ	Bedamintan / fool rekaket
2	મુક્કેબાજી	Boxing	બોક્સિંગ	બોક્સિંગ	boksing
3	ફુટબાલ	Football	ફૂટબોલ	ફૂટબોલ	footabol
4	તૈરાકી	Swimming	તરવું	તરવું	taravun
5	ખાલા ફેંક	Javelin throw	બરછી ફેંકવું / ખાલા ફેંક	બરછી ફેંકવું / ખાલા ફેંક	barachhee fenkavun / bhalaa fenk
6	ગોલા ફેંક	Shot put	શોટ પુટ / ગોળા ફેંક	શોટ પુટ / ગોળા ફેંક	shot put / gola fek
7	તલવારબાજી	Fencing	તલવાર બાજી	તલવાર બાજી	talavaar baajee
8	વાંસ કૂદ	Pole Vault	વાંસ કૂદકો	વાંસ કૂદકો	vaans koodako
9	લાંબી કૂદ	Long - jump	લાંબી કૂદ	લાંબી કૂદ	laanbee kood
10	હોકી	Hokey	હોકી	હોકી	hokee
11	ગોલ્ફ	Golf	ગોલ્ફ	ગોલ્ફ	golf
12	ટેનિસ	Tennis	ટેનિસ	ટેનિસ	tenis
13	કુશ્તી	Wrestling	કુશ્તી	કુશ્તી	kustee
14	પોલો	Polo	પોલો	પોલો	polo
15	ખારોત્તલન	Weight Lifting	વજન ઉપાડવું	વજન ઉપાડવું	vajan upaadavun
16	શતરંજ	Chess	શતરંજ	શતરંજ	shataranj
17	કૈરમ	Carom	કૈરમ	કૈરમ	keram
18	ક્રિકેટ	Cricket	ક્રિકેટ	ક્રિકેટ	kriket
19	ખો ખો	KhoKho	ખો ખો	ખો ખો	kho kho
20	ટેબલ ટેનિસ	Table Tennis	ટેબલ ટેનિસ	ટેબલ ટેનિસ	tebal tenis
21	ગિલ્લી ડન્ડા	Gilli Danda	ગીલી દંડો	ગીલી દંડો	geelee dndo
22	બાસ્કેટબાલ	Basket Ball	બાસ્કેટબોલ	બાસ્કેટબોલ	baasketabol
23	કબડડી	Kabaddi	કબડ્ડી	કબડ્ડી	kabaddee

**કાર્યાલયીન વસ્તુ Office Items**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	કલમ, પેન	PEN	પેન	પેન	pen
2	કાગજ	PAPER	કાગળ	કાગલ	kaagal
3	સ્યાહી	INK	શાહી	શાહી	shaahee
4	રબડ	RUBBER	રબર	રબર	rabar
5	રજત પટ	White Board	વ્હાઇટ બોર્ડ	વ્હાઇટ બોર્ડ	vhaait bord
6	પુસ્તક	BOOK	પુસ્તક	પુસ્તક	pustak
7	પંજી / પંજિકા	REGISTER	નોંધણી / નોંધણી	નોંધણી / નોંધણી	nondhane / nondhane
8	પૈમાના	SCALE	માપ	માપ	maap
9	અભ્યાસ પુસ્તિકા	COPY	અભ્યાસ પુસ્તક	અભ્યાસ પુસ્તક	abhyaas pustak
10	કૈંચી	SCISSOR	કાતર	કાતર	kaatar
11	સભાગાર	Conference Hall	સભાગૃહ	સભાગૃહ	sabhaagrih
12	લેખન પૈડ	WRITING PAD	લેખન પેડ	લેખન પેડ	lekhan ped
13	દૂરભાષ યંત્ર	TELEPHONE	ટેલિફોન ઉપકરણ	ટેલિફોન ઉપકરણ	telefon upakaran
14	સંદર્શન પત્ર	VISITING CARD	ઓળખ પત્ર	ઓળખ પત્ર	olakh patr
15	ગૌંદ	GUM BOTTLE	ગુંદર	ગુંદર	gundar
16	મુહર	STAMP	સિક્કો	સિક્કો	sikko
17	ગણક યંત્ર	CALCULATOR	કેલ્ક્યુલેટર	કેલ્ક્યુલેટર	kelkyuletar
18	લિફાફા	ENVELOPES	પરબિડીયું	પરબિડીયું	parabideeyun
19	રબડ કા છલ્લા	RUBBER BAND	રબર રિંગ	રબર રિંગ	rabar ring
20	સૂચના પટલ	NOTICE BOARD	નોટિસ બોર્ડ	નોટિસ બોર્ડ	Notis Bord
21	ઉપસ્થિતિ પત્ર	MUSTER ROLL	હાજરી પત્રક	હાજરી પત્રક	haajaree patrak
22	સંગણક	COMPUTER	કમ્પ્યુટર	કમ્પ્યુટર	kampyutar
23	કુંજી પટલ	KEYBOARD	કીબોર્ડ	કીબોર્ડ	keebord
24	મુદ્રણ યંત્ર	PRINTER	પ્રિન્ટીંગ મશીન	પ્રિન્ટીંગ મશીન	printeeng masheen
25	નામ પટ્ટ	Name Board	નામ બોર્ડ	નામ બોર્ડ	naam bord

સમય-સૂચક શબ્દ Time Related Words

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	પલ	Moment	ક્ષણ	ક્ષણ	kshan
2	સેકેન્ડ	second	સેકન્ડ	સેકન્ડ	sekand
3	મિનટ	Minute	મિનિટ	મિનિટ	minit
4	ઘંટા	Hour	કલાક	કલાક	kalaak
5	સુબહ	Morning	સવાર	સવાર	savaar
6	દોપહર	Afternoon	બપોર	બપોર	bapor
7	સંધ્યા / સાયં / શામ	evening	સાંજ	સાંજ	saanj
8	રાત	Night	રાત્રિ	રાત્રિ	raatri
9	દિન	Day	દિવસ	દિવસ	divas
10	રોજ / દૈનિક	Daily	દૈનિક	દૈનિક	dainik
11	આજ	Today	આજે	આજે	aaje
12	કલ / બીતા હુઆ કલ	yesterday	ગઈકાલે	ગઈકાલે	gaikaale
13	કલ / આને વાલા	Tomorrow	આવતી કાલે	આવતી કાલે	aavatee kaale
14	પરસો / બીતા હુઆ	Day before yesterday	ગઈકાલ પહેલા નો દિવસ	ગઈકાલ પહેલા નો દિવસ	gaiikaal pahelaa no divas
15	પરસો / આને વાલા	Day After Tomorrow	પરમ દિવસ	પરમ દિવસ	param divas
16	સપ્તાહ	Week	સપ્તાહ	સપ્તાહ	saptaah
17	પખવાડા	fortnight	પખવાડિયું	પખવાડિયું	pakhavaadiyun
18	માસ / માહ / મહિના	month	માસ	માસ	maas
19	ત્રિમાસી	quarterly	ત્રિમાસિક	ત્રિમાસિક	trimaasik
20	છમાસી	half yearly	અર્ધવાર્ષિક	અર્ધવાર્ષિક	ardhavaarshik
21	વાર્ષિક	Yearly	વાર્ષિક	વાર્ષિક	vaarshik
22	વર્ષ / સાલ	Year / Annum	વર્ષ / વાર્ષિક	વર્ષ / વાર્ષિક	varsh / vaarshik
23	દશક / દસ સાલ	Decade / Ten years	દાયકા / દસ વર્ષ	દાયકા / દસ વર્ષ	daayakaa / das varsh
24	શતાબ્દી / સૌ સાલ	Centenary / hundred years	શતાબ્દી/સૌ વર્ષ	શતાબ્દી/સૌ વર્ષ	shataabdee/so varsh
25	યુગ	Era / age	યુગ	યુગ	yug
26	કબ / જબ	When	ક્યારે	ક્યારે	kyaare
27	તબ	Then	પછી	પછી	pachhee



પક્ષી / જલચર Birds / Waterfowls

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	સારસ	CRANE	સારસ	સારસ	saaras
2	મોર	PEACOCK	મોર	મોર	mor
3	કબૂતર	PIGION	કબૂતર	કબૂતર	kabootar
4	તોતા	PARROT	પોપટ	પોપટ	popat
5	મૈના	MYNAH	મૈના	મૈના	mainaa
6	કૌઆ	CROW	કાગડો	કાગડો	kaagado
7	બત્તખ	DUCK	બતક	બતક	batak
8	ઉલ્લૂ	OWL	ઘુવડ	ઘુવડ	ghuvad
9	કોયલ	CUCKOO	કોયલ	કોયલ	koyal
10	ગૌરયા	SPARROW	ચકલી	ચકલી	chakalee
11	શુતરમુર્ગ	OSTRICH	શાહમુર્ગ	શાહમુર્ગ	shaahamrig
12	તીતર	PARTRIDGE	તીતર	તીતર	teetar
13	ગિન્દ્ર	VULTURE	ગીધ	ગીધ	geedh
14	ચીલ	EAGLE	ગરુડ	ગરુડ	garud
15	હંસ	SWAN	હંસ	હંસ	hns
16	ચમગાદડ	BAT	બેટ / ચામાચીડિયું	બેટ / ચામાચીડિયું	bet/ chaamaacheediyun
17	રામ ચિરૈયા	KING FISHER	રામ ચિરયા / કાબર	રામ ચિરયા / કાબર	raam chirayaa / kaabar
18	બગુલા	Heron	બગલો	બગલો	bagalo
19	કછુઆ	TURTLE	કાચબો	કાચબો	kaachabo
20	તારા મછલી	STARFISH	સ્ટારફિશ / તારા માછલી	સ્ટારફિશ / તારા માછલી	staarafish / taaraa maachhalee
21	કેકડા	CRAB	કરચલો	કરચલો	karachalo
22	સીપ	OYSTER	છીપ	છીપ	chheep
23	ઝીંગા મછલી	LOBSTER	પ્રોન માછલી / જિંગા	પ્રોન માછલી / જિંગા	pron maachhalee / jingaa
24	ઘડિયાલ	ALIGATOR	મગર	મગર	magar
25	ઠુદબિલાવ	OTTER	જળબિલાડી	જળબિલાડી	Jal Biladi
26	દરિયાઈ ઘોડા	HIPPOPOTOMUS	હિપ્પોપોટેમસ	હિપ્પોપોટેમસ	hippopotemas
27	મછલી	FISH	માછલી	માછલી	maachhalee

**વાહન Vehicles**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	રથ	Car	કાર	કાર	kaar
2	દુપહિયા વાહન	Two wheeler	ટુ વ્હીલર	ટુ વ્હીલર	tu vheelar
3	ત્રિપહિયા વાહન	Tricycle	થ્રી વ્હીલર	થ્રી વ્હીલર	three vheelar
4	રોગી વાહન	Ambulance	દરદી વાહન	દર્દી વાહન	dardee vaahan
5	પુલિસ વાહન	Police Van	પોલીસ વાહન	પોલીસ વાહન	polees vaahan
6	હવાઈ જહાજ	Aeroplane	વમિાન	વિમાન	vimaan
7	માલગાડી	Goods Train	માલ ગાડી	માલ ગાડી	maal gaadee
8	ખોદક યંત્ર	Excavator	ઉત્ખનન	ઉત્ખનન	utkhanan
9	આપૂર્તિ વાહન	Delivery Van	સપ્લાય વાહન	સપ્લાય વાહન	saplaay vaahan
10	જલ વાહક વાહન	Water Tanker	પાણી વાહક	પાણી વાહક	paanee vaahak
11	જલયાન	Ship	વહાણ	વહાણ	vahaan
12	પનડુબ્બી	Submarine	સબમરીન	સબમરીન	sabamareen
13	પાલનૌકા	Sailboat	નૌકા	નૌકા	naukaa
14	ભૂમિગત રેલ	Subway Rail	ભૂગર્ભ રેલ	ભૂગર્ભ રેલ	bhoogarbh rel
15	નાવ	Boat	હોડી	હોડી	hodee
16	નૌકા	Yacht	યાટ	યાટ	yaat
17	ડોંગી	Canoe	નાવડી	નાવડી	naavadee
18	દમકલ ગાડી	Fire Brigade	અગ્નિ શામક દળ	અગ્નિ શામક દલ	agni shaamak dal
19	બૈલ ગાડી	Bullock Cart	બલદ ગાડું	બલદ ગાડું	balad gaadun
20	ઠેલા	Trolley	ટ્રોલી	ટ્રોલી	trolee
21	તાંગા	Tonga	ટોંગા / ઘોડા ગાડી	ટોંગા / ઘોડા ગાડી	tongaa/ ghoda gaadee

રિશ્તે નાતે Relations

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	માઁ	Mother	માતા	માતા	mata
2	પિતા	Father	પિતા	પિતા	pita
3	ભાઈ	Brother	ભાઈ	ભાઈ	bhaii
4	બહન	Sister	બહેન	બહેન	bahen
5	દાદા	Grandfather	દાદા	દાદા	dada
6	દાદી	Grandmother	દાદીમા	દાદીમા	dadeema
7	ચાચા	Uncle	કાકા	કાકા	kaka
8	ચાચી	Aunty	કાકી	કાકી	kakee
9	પુત્ર, બેટા	Son	પુત્ર	પુત્ર	putr
10	પુત્રી, બેટી	Daughter	દીકરી	દીકરી	deekaree
11	પ્રપૌત્ર, પોતા, નાતી	Grandson	પૌત્ર	પૌત્ર	pautr
12	પ્રપૌત્રી, પોતી, નાતિન	Granddaughter	પૌત્રી	પૌત્રી	pautree
13	ભત્રીજા	Nephew	ભત્રીજા	ભત્રીજા	bhatreeja
14	ભત્રીજી	Niece	ભત્રીજી	ભત્રીજી	bhatreejee
15	ભાંજા	Nephew	ભાણિયો	ભાણિયો	bhaaniyo
16	ભાંજી	Niece	ભાણી	ભાણી	Bhani
17	બુઆ	Aunty	ફોઈ	ફોઈ	foi
18	ફૂફા	Uncle	ફુવા	ફુવા	fuva
19	નાના	Grandfather	નાના	નાના	nana
20	નાની	Grandmother	નાની	નાની	nanee
21	મામા	Maternal Uncle	મામા	મામા	mama
22	મામી	Maternal Aunt	મામી	મામી	maamee
23	મૌસી	Aunty	માસી	માસી	masee
24	મૌસા	Uncle	માસા	માસા	masa
25	સાસ	Mother in law	સાસુ	સાસુ	sasu
26	સસુર	Father in law	સસરા	સસરા	sasaraa
27	સાલા	Brother in law	બનેવી	બનેવી	banevee
28	સાલી	Sister in law	શાળી	શાળી	shalee
29	પત્ની	Wife	પત્ની	પત્ની	patnee
30	પતિ	Husband	પતિ	પતિ	pati

રિશ્તે નાતે Relations

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	નનદ	Sister in law	નણંદ	નणंद	nannd
2	દેવર	Brother in law	દયિર	दियर	diyar
3	ભાભી	Sister in law	ભાભી	भाभी	bhaabhee
4	પતિ	Husband	પતિ	पति	pati
5	પત્ની	Wife	પત્ની	पत्नी	patnee
6	જીજા	Brother in law	બનેવી	बनेवी	banevee
7	દામાદ	Son In Law	જમાઈ	जमाई	jamaaii
8	તાઈ	Aunty	કાકી	काकी	kaakee
9	તાઝુ	Uncle	કાકા	काका	kaakaa
10	પુત્રવધૂ, બહુ	Daughter In Law	પુત્રવધૂ	पुत्रवधू	putravadhoo
11	સાઢૂ	Co brother	સાઢૂ	साढु	saadhu
12	જુડવા	Twins	જોડયા	जोडिया	jodiyaa
13	ચચેરા ભાઈ	Cousin brother	પતિરાઈ ભાઈ	पितराई भाई	pitaraaii bhaaii
14	ચચેરી બહન	Cousin Sister	પતિરાઈ બહેન	पितराई बहन	pitaraaii bahan
15	મમેરા ભાઈ	Cousin brother	માતાના પતિરાઈ ભાઈ	माताना पितराई भाई	maataanaa pitaraaii bhaaii
16	મમેરી બહન	Cousin Sister	પતિરાઈ બહેન	पितराई बहन	pitaraaii bahan
17	મોસેરા ભાઈ	Cousin brother	મોસેરા પતિરાઈ	मोसेरा पितराई	mosera pitaraaii
18	મોસેરી બહન	Cousin Sister	પતિરાઈ બહેન	पितराई बहन	pitaraaii bahan
19	ફુફેરા ભાઈ	Cousin brother	પતિરાઈ ભાઈ	पितराई भाई	pitaraaii bhaaii
20	ફુફેરી બહન	Cousin Sister	પતિરાઈ બહેન	पितराई बहन	pitaraaii bahan
21	સૌતેલા ભાઈ	Step Brother	સાવકા ભાઈ	सावका भाई	saavakaa bhaaii
22	સૌતેલી બહન	Step Sister	સાવકી બહેન	सावकी बहन	saavakee bahan
23	સૌતેલી માં	Step Mother	સાવકી મા	सावकी मा	saavakee maa
24	સૌતેલા પિતા	Step Father	સાવકા પિતા	सावका पिता	saavakaa pitaa
25	દત્તક પુત્ર	Adopted Son	દત્તક પુત્ર	दत्तक पुत्र	dattak putr
26	દત્તક પુત્રી	Adopted Daughter	દત્તક પુત્રી	दत्तक पुत्री	dattak putree

**કાર્યાલય Offices**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	કેન્દ્રીય કાર્યાલય	Central Office	કેન્દ્રીય કચેરી	કેન્દ્રીય કચેરી	kendreey kacheree
2	આંચલિક કાર્યાલય	Zonal Office	આંચલિક કચેરી	આંચલિક કચેરી	aanchalik kacheree
3	ક્ષેત્રીય કાર્યાલય	Regional Office	ક્ષેત્રીય કચેરી	ક્ષેત્રીય કચેરી	kshetreey kacheree
4	શાખા કાર્યાલય	Branch Office	શાખા કચેરી	શાખા કચેરી	shaakhaa kacheree
5	આંચલિક લેખાપરીક્ષા કાર્યાલય	Zonal Audit Office	ઝોનલ ઓડિટ કચેરી	ઝોનલ ઓડિટ કચેરી	jhonal odit kacheree
6	ગૈર-વ્યાવસાયિક કાર્યાલય	Non Business Office	બિન-વ્યાવસાયિક કચેરી	બિન-વ્યાવસાયિક કચેરી	bin-vyavasaayik kacheree
7	પ્રશિક્ષણ મહાવિદ્યાલય	Training College	તાલીમ કોલેજ	તાલીમ કોલેજ	taaleem kolej
8	જ્ઞાનાર્જન એવં વિકાસ કેન્દ્ર	Centre for Learning and Development	અધ્યયન અને વિકાસ કેન્દ્ર	અધ્યયન અને વિકાસ કેન્દ્ર	adhyayan ane vikaas kendr
9	સચિવાલય	Secretariat	સચિવાલય	સચિવાલય	sachivaalay
10	નગરપાલિકા કાર્યાલય	Municipal Office	મ્યુનિસિપલ ઓફિસ	મ્યુનિસિપલ ઓફિસ	myunisipal ofis
11	કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક કાર્યાલય	Central Excise Office	સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસ	સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસ	sentral eksaaijh ofis
12	વિવાહ પંજીકરણ કાર્યાલય	Marriage Registration Office	લગ્ન નોંધણી કચેરી	લગ્ન નોંધણી કચેરી	lagn nondhane kacheree
13	ક્ષેત્રીય પરિવહન કાર્યાલય	Regional Transport Office	પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી	પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી	praadeshik vaahanavyavahaar kacheree
14	કેન્દ્રીય સાંખ્યિકીય કાર્યાલય	Central Statistics Office	કેન્દ્રીય આંકડાકીય કચેરી	કેન્દ્રીય આંકડાકીય કચેરી	kendreey aankadakeey kacheree
15	જિલા કોષાગાર	District Treasury Office	જિલ્લા તજોરી	જિલ્લા તિજોરી	jillaa tijoree
16	આહરણ વ સંવિતરણ કાર્યાલય	Drawing & Disbursing Office	ડ્રોઇંગ અને ડિસ્બર્સિંગ ઓફિસ	ડ્રોઇંગ અને ડિસ્બર્સિંગ ઓફિસ	droing ane disbarsing ofis
17	ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય	Regional Passport Office	પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ	પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ	praadeshik paasaport ofis
18	ડાકઘર	Post Office	પોસ્ટ ઓફિસ	પોસ્ટ ઓફિસ	post ofees
19	શ્રમાયુક્ત કા કાર્યાલય	Office of The Labour Commissioner	શ્રમ કમિશનરની કચેરી	શ્રમ કમિશનરની કચેરી	shram kamishanarane kacheree
20	નિદેશાલય	Directorate	નિર્દેશલય કચેરી	નિર્દેશલય કચેરી	nirdeshalay kacheree

**પદનામ Designations**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	અધ્યક્ષ	Chairman	અધ્યક્ષ	અધ્યક્ષ	adhyaksh
2	પ્રબંધ નિદેશક	Managing Director	પ્રબંધ નિદેશક	પ્રબંધ નિદેશક	prabndh nirdeshak
3	મુખ્ય કાર્યકારી અધિકારી	Chief Executive Officer	મુખ્ય કારોબારી અધિકારી	મુખ્ય કારોબારી અધિકારી	mukhy karobaaree adhikaaree
4	કાર્યપાલક નિદેશક	Executive Director	કાર્યપાલક નિદેશક	કાર્યપાલક નિદેશક	kaaryapaalak nirdeshak
5	મુખ્ય સતર્કતા અધિકારી	Chief Vigilence Officer	મુખ્ય તકેદારી અધિકારી	મુખ્ય તકેદારી અધિકારી	mukhy takedaaree adhikaaree
6	બેંકિંગ લોકપાલ	Banking Ombudsman	બેંકિંગ લોકપાલ	બેંકિંગ લોકપાલ	benking lokapal
7	મહાપ્રબન્ધક	General Manager	જનરલ મેનેજર	જનરલ મેનેજર	janaral menejar
8	ફીલ્ડ મહાપ્રબન્ધક	Field General Manager	ફિલ્ડ જનરલ મેનેજર	ફિલ્ડ જનરલ મેનેજર	fild janaral menejar
9	કંપની સચિવ	Company Secretary	કંપની સચિવ	કંપની સચિવ	knpanee sachiv
10	આંચલિક પ્રબન્ધક	Zonal Manager	ઝોનલ મેનેજર	ઝોનલ મેનેજર	jhonal menejar
11	ઉપ મહાપ્રબન્ધક	Deputy General Manager	ડેપ્યુટી જનરલ મેનેજર	ડેપ્યુટી જનરલ મેનેજર	depyutee janaral menejar
12	મુખ્ય આંતરિક લેખાપરીક્ષક	Chief Internal Auditor	મુખ્ય આંતરિક ઓડિટર	મુખ્ય આંતરિક ઓડિટર	mukhy aantarik oditar
13	પ્રાચાર્ય	Principal	આચાર્યશ્રી	આચાર્યશ્રી	aachaaryashree
14	ક્ષેત્રીય પ્રબન્ધક	Regional Manager	પ્રાદેશિક વ્યવસ્થાપક	પ્રાદેશિક વ્યવસ્થાપક	praadeshik vyavasthaapak
15	સહાયક મહાપ્રબન્ધક	Asstt. General Manager	સહાયક જનરલ મેનેજર	સહાયક જનરલ મેનેજર	sahaayak janaral menejar
16	મુખ્ય પ્રબન્ધક	Chief Manager	ચીફ મેનેજર	ચીફ મેનેજર	cheef menejar
17	વરિષ્ઠ પ્રબન્ધક	Senior Manager	વરિષ્ઠ મેનેજર	વરિષ્ઠ મેનેજર	varishth menejar
18	સંકાય પ્રમુખ	Feculty Leader	ફેકલ્ટીના વડા	ફેકલ્ટીના વડા	fekalteenaa vada
19	પ્રબન્ધક	Manager	મેનેજર	મેનેજર	menejar
20	સહાયક પ્રબન્ધક	Asstt. Manager	આસિસ્ટન્ટ મેનેજર	આસિસ્ટન્ટ મેનેજર	aasistant menejar
21	ઉપ પ્રબન્ધક	Deputy Manager	ડેપ્યુટી મેનેજર	ડેપ્યુટી મેનેજર	depyutee menejar
22	વિધિ અધિકારી	Law Officer	કાયદા અધિકારી	કાયદા અધિકારી	kayada adhikaree
23	સુરક્ષા અધિકારી	Securty Officer	સુરક્ષા અધિકારી	સુરક્ષા અધિકારી	suraksha adhikaree
24	રાજભાષા અધિકારી	Rajbhasha Officer	રાજભાષા અધિકારી	રાજભાષા અધિકારી	rajabhasha adhikaree
25	વૈયક્તિક સચિવ	Pesonel Secretary	અંગત સચિવ	અંગત સચિવ	angat sachiv
26	કૃષિ વિત્ત અધિકારી	Agriculture Finance Officer	કૃષિ ધિરાણ અધિકારી	કૃષિ ધિરાણ અધિકારી	krishi dhiran adhikaaree
27	સૂચના તકનીક અધિકારી	Information Technology Offcer	માહિતી ટેકનોલોજી અધિકારી	માહિતી ટેકનોલોજી અધિકારી	mahitee tekanoloojee adhikaree

**પદનામ Designations**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	અભિયંતા	Engineer	ઇજનેર	इजनेर	Ijaner
2	આંતરિક લેખાપરીક્ષક	Internal Auditor	આંતરિક ઓડિટર	आंतरिक ओडिटर	aantarik oditar
3	વ્યવસાય પ્રતિનિધિ	Business Correspondence	વ્યવસાય પ્રતિનિધિ	व्यवसाय प्रतिनिधि	vyavasaay pratinidhi
4	વિપણન અધિકારી	Marketing Officer	માર્કેટિંગ અધિકારી	मार्केटिंग अधिकारी	marketing adhikaaree
5	માનવ સંસાધન વિશેષજ્ઞ	Human Resource Specialist	માનવ સંસાધન નિષ્ણાત	मानव संसाधन निष्णात	maanav snsaadhan nishnat
6	મુખ્ય ખજાંચી	Chief Cashier	મુખ્ય કેશિયર	मुख्य केशियर	mukhy keshiyar
7	પ્રધાન ખજાંચી	Head Cashier	હેડ કેશિયર	हेड केशियर	hed keshiyar
8	ગણક	Tailor	ગણક	गणक	ganak
9	ટંકક	Typist	ટાઇપસ્ટિ	टाइपिस्ट	taaipist
10	એકલ ખિડકી પરિચાલક	Single Window Operator	સિંગલ વન્ડો ઓપરેટર	सिंगल विन्डो ओपरेटर	singal vindo oparetar
11	લિપિક	Clerk	કારકુન	कारकुन	kaarakun
12	દફતરી	Daftary	દફતરી	दफतरी	dafataree
13	સશસ્ત્ર પ્રહરી	Armed Guard	સશસ્ત્ર રક્ષક	सशस्त्र रक्षक	sashastr rakshak
14	વાહન ચાલક	Driver	વાહન ચાલક	वाहन चालक	vaahan chaalak
15	અધીનસ્થ કર્મચારી	Sub Staff	સબ સ્ટાફ	सब स्टाफ	sab staaf

**વાદ્ય યંત્ર Musical Instruments**

ક્રમ	હિન્દી	ઍંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	શંખ	Conch	શંખ	શંખ	Shankh
2	મજીરા	Cymbal	મંજીરા	મંજીરા	manjeeraa
3	ઢોલ યા નગાડા	Drum	ડ્રમ અથવા નગારું	ડ્રમ અથવા નગારું	dram athavaa nagaarun
4	શહનાઈ	Clarinet	શરણાઈ	શરણાઈ	Sharnai
5	સારંગી	Harp	તારવાળું સાધન / સારંગી	તારવાળું સાધન / સારંગી	taaravalun sadhan / sarngee
6	બાંસુરી	Flute	વાંસળી	વાંસળી	vaansalee
7	ડુગડુગી	Drum let	ડમરૂં	ડમરૂં	Damru
8	ગિટાર	Guitar	ગટાર	ગિટાર	gitaar
9	વાયલિન	Violin	વાયોલિન	વાયોલિન	vaayolin
10	પિયાનો	Piano	પિયાનો	પિયાનો	piyaano
11	ડફલી	Tambourine	ડફલી	ડફલી	dafalee
12	હારમોનિયમ	Harmonium	હાર્મોનિયમ	હાર્મોનિયમ	haarmoniyam
13	બિગુલ	Bugle	બ્યુગલ	બ્યુગલ	byugal
14	મુખ વાદ્ય	Mouth organ	મોઢે થી અવાજનું સાધન	મોઢે થી અવાજનું સાધન	modhe thee avajanun sadhan
15	તબલા	Tabor	તબલા	તબલા	tabalaa
16	ઘંટા	Gong	ઘંટ	ઘંટ	ghnt
17	સિતાર	Sitar	સિતાર	સિતાર	sitaar
18	બાંસુરી	Flute	વાંસળી	વાંસળી	vaansalee
19	બેંજો	Banjo	બેન્જો	બેન્જો	benjo
20	ઢોલક	Tomtom / Dholak	ઢોલક	ઢોલક	dholak
21	મૃદંગ	Mrudang	મૃદંગ	મૃદંગ	mridang
22	ઘૂંઘરૂં	Anklet bells	પગની ઘંટડી / ઘૂંઘરૂં	પગની ઘંટડી / ઘૂંઘરૂં	paganee ghntadee / ghoongharun



**માપ સૂચક શબ્દ Measurement Keywords**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ગ્રામ	gram	ગ્રામ	ગ્રામ	graam
2	કિલોગ્રામ	kilogram	કલિગ્રામ	કિલોગ્રામ	kilograam
3	ક્વિન્ટલ	quintal	ક્વિન્ટલ	ક્વિન્ટલ	kvintal
4	ટન	Ton	ટન	ટન	tan
5	મિલીમીટર	Millimeter	મલિમીટર	મિલિમીટર	Mili meetar
6	સેન્ટીમીટર	Centimeter	સેન્ટીમીટર	સેન્ટીમીટર	senteemeetar
7	મીટર	Meter	મીટર	મીટર	meetar
8	ડેકામીટર	Decameter	ડેકામીટર	ડેકામીટર	dekameetar
9	હેક્ટોમીટર	Hectometer	હેક્ટોમીટર	હેક્ટોમીટર	hektomeetar
10	કિલોમીટર	Kilometer	કલિમીટર	કિલોમીટર	kilomeetar
11	ગજ	Yard	વાર	વાર	vaar
12	એકર	Acre	એકર	એકર	ekar
13	મીલ	Mile	માઇલ	માઇલ	maail
14	સમુદ્રી મીલ	Nautical Miles	નોટિકલ માઇલ	નોટિકલ માઇલ	notikal maail
15	ફીટ	Feet	ફૂટ	ફુટ	Foot
16	મીલ	Mile	માઇલ	માઇલ	maail
17	ફર્લોંગ	Furlong	ફરલોંગ	ફરલોંગ	faralong
18	લીટર	Liter	લિટર	લિટર	litar
19	મિલીલીટર	Milliliter	મલિલીટર	મિલીલીટર	mileeleetar

रेलवे स्टेशन पर संवाद. Conversation at Railway Station

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	यात्री- कृपया मुंबई जाने वाली ट्रेन की क्या स्थिति बताएं.	Passanger - What is the status of Mumbai superfast.	पेसेन्जर- महेरबानी करीने जणावो के मुंबई जती ट्रेननी शुं स्थिति छे.	पेसेन्जर- महेरबानी करीने जणावो के मुंबई जती ट्रेननी शुं स्थिति छे.	Pesenjar-maherabaneekareene janavo ke munbairi jatee trenanee shun sthiti chhe.
2	ये ट्रेन अपने निर्धारित समय से चार घंटे की देरी से चल रही है.	The train is running late by 4 hours from its scheduled time	आ ट्रेन तेना निर्धारित समय करता यार क्वाक मोडी यावी रही छे.	आ ट्रेन तेना निर्धारित समय करता चार कलाक मोडी चाली रही छे.	Aa tren tena nirdhaarit samay karataa chaar kalaak modee chaalee rahee chhe.
3	यात्री- क्या गोवा की किसी ट्रेन में रिजर्वेशन मिल सकेगा.	Passanger - Will reservation available in any train to Goa.	पेसेन्जर- शुं गोवा जती कोई ट्रेनमां रिजर्वेशन मणशे?	पेसेन्जर- शुं गोवा जती कोई ट्रेनमां रिजर्वेशन मळशे?	Pesenjar- shun govaa jati koi trenaman rijharveshan malashe?
4	आज की किसी भी ट्रेन में नहीं है, हाँ, कल सुबह की ट्रेन में है	It is not available in any train today, but available in tomorrow morning's train.	आजनी कोई ट्रेनमां नहीं, हा, काले सवारनी ट्रेन मां मळसे	आजनी कोई ट्रेनमां नहीं, हा, काले सवारनी ट्रेन मां मळसे	Aajanee koi trenamaan naheen, haa, kaale savaaraneetren maan malase
5	दिल्ली के लिए कोई ट्रेन है क्या	Is there any train for Delhi?	शुं दिल्डी जवा माटे कोई ट्रेन छे?	शुं दिल्ली जवा माटे कोई ट्रेन छे?	shun dilhee javaa maate koi tren chhe?
6	जी एक ट्रेन है जो वाया भोपाल होकर जाती है.	Yes, there is a via Bhopal train.	हा, एक ट्रेन छे जे भोपाल थईने जाय छे.	हा, एक ट्रेन छे जे भोपाल थईने जाय छे	Haa, ek tren chhe je bhopaal thaiine jaay chhe
7	बड़ौदा एक्सप्रेस कौन से प्लेटफार्म पर आएगी.	Which platform will Baroda express come at?	बरोडा एक्सप्रेस कया प्लेटफोर्म पर आवशे?	बरोडा एक्सप्रेस कया प्लेटफोर्म पर आवशे?	baroda eksapres kayaa pletaform par aavashe?
8	यह गाड़ी प्लेटफॉर्म नम्बर अठारह पर आएगी.	This train will come at platform number eighteen.	आ ट्रेन प्लेटफोर्म नंबर अठार पर आवशे.	आ ट्रेन प्लेटफोर्म नंबर अठार पर आवशे.	Aa tren pletaform nnbar adhaar par aavashe.
9	महोदय, क्या इस स्टेशन पर कोई दवाई की दुकान है.	Sir, is there any medicine shop at this station.	सर, शुं आ स्टेशन पर कोई दवाणी दुकान छे?	सर, शुं आ स्टेशन पर कोई दवाणी दुकान छे?	Sar, shun aa steshan par koi davaanee dukaan chhe?
10	स्टेशन के बाहर ही है.	Just outside the station.	ते स्टेशननी बहार ज छे.	ते स्टेशननी बहार ज छे.	Te steshananeebahaar j chhe.
11	मेरी माँ वृद्ध है, उनके लिए व्हील चेयर चाहिए.	My mother is old, I want a wheel chair for her.	मारी माता वृद्ध छे, तेमने व्हील चेरनी जरूर छे.	मारी माता वृद्ध छे, तेमने व्हील चेरनी जरूर छे.	Maareemaataa vridhd chhe, temane vheel cheranee jaroor chhe.
12	जी, अवश्य मिलेगी. इसके लिए आप कुली से बात कीजिये.	Yes, sure, please ask a coolie for the same.	हा, योक्कस मणशे आ माटे तमे कुली साथे वात करो.	हा, चोक्कस मळशे आ माटे तमे कुली साथे वात करो.	Haa, chokkas malshe . Aa maate tame kulee saathe vaat karo.

सेंट सरल भाषा ४ शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

कार्यालय में स्टाफ से संवाद. Conversation with office staff

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	स्टाफ 1: नमस्कार. आपका हमारे कार्यालय में स्वागत है	Staff 1: Hello. Welcome to our office.	स्टाफ 1: डेली. अमारी ओफिसिमां आपनुं स्वागत छे.	स्टाफ 1: हेलो. अमारी ओफिसिमां आपनुं स्वागत छे.	Staaf 1: helo. Amaree ofisamaan aapanun swaagat chhe.
2	स्टाफ 1: कृपया बैठिए.	Staff 1: Please sit down.	स्टाफ 1: कृपा करीने बेसो.	स्टाफ 1: कृपा करीने बेसो.	Staaf 1:kripaa kareene beso.
3	स्टाफ 1: आप क्या लेना पसंद करेंगे - चाय या कॉफी.	Staff 1: What you would like to have, tea or coffee.	स्टाफ 1: तमे शुं वेशो, या के कोड़ी.	स्टाफ 1: तमे शुं लेशो, चा के कोफी.	Staaf 1: tame shun lesho, chaa ke kofee.
4	स्टाफ 2: मैं चाय ले लूंगा.	Staff 2: I would like tea.	स्टाफ 2: मने या जोधये छे.	स्टाफ 2: मने चा जोईए छे.	Staaf 2: mane chaa joiie chhe.
5	स्टाफ 1: आपका परिवार कहाँ है.	Staff 1: Where is Your family	स्टाफ 1: तमारो परिवार इयां छे	स्टाफ 1: तमारो परिवार क्यां छे	Staaf 1: tamaaro parivaar kyaan chhe
6	स्टाफ 2: वे दिल्ली में हैं.	Staff 2: They are in Delhi.	स्टाफ 2: तेओ दिल्डीमां छे.	स्टाफ 2: तेओ दिल्लीमां छे.	staaf 2 : teo dilheemaan chhe.
7	स्टाफ 2: यहां कार्यालय में कुल कितना स्टाफ है.	Staff 2: How much staff is there in the office?	स्टाफ 2: ओफिसिमां केटलो स्टाफ छे.	स्टाफ 2: ओफिसिमां केटलो स्टाफ छे.	Staaf 2 : ofisamaan ketalo staaf chhe.
8	स्टाफ 1: यहाँ कुल 25 स्टाफ है जिसमें 15 अधिकारी, 06 लिपिक और 04 अधीनस्थ हैं.	Staff 1: There are total 25 including 15 officers, 06 clerk and 04 subordinate staff.	स्टाफ 1: कुल 25 स्टाफ छे जेमां 15 अधकारीओ, 06 कारकुन अने 04 पटावाला छे.	स्टाफ 1: कुल 25 स्टाफ छे जेमां 15 अधिकारीओ, 06 कारकुन अने 04 पटावाला छे.	Staaf 1: kul 25 staaf chhe jemaan 15 adhikareeo, 06 karakun ane 04 patavala chhe.
9	स्टाफ 1: गुजरात राज्य में क्या आपकी ये पहली पदस्थापना है.	Staff 1: Is this your first posting in Gujarat state?	स्टाफ 1: शुं गुजरात राज्यमां आ तमारी प्रथम पोस्टिंग छे.	स्टाफ 1: शुं गुजरात राज्यमां आ तमारी प्रथम पोस्टिंग छे.	Staaf 1 : shun gujaraat raajyamaan aa tamaaree pratham posting chhe.
10	स्टाफ 2 : जी हां,	Staff 2 : yes	स्टाफ 2: हा,	स्टाफ 2: हा,	Staaf 2 : haa,
11	स्टाफ 1: इसके पूर्व आप कहां कहां रहे हैं.	Staff 1 : Where have you been before.	स्टाफ 1: तमे पडेवा इयां छे?	स्टाफ 1: तमे पहेला क्यां हता?	staaf 1 : tame pahelaa kyaan hataa?
12	स्टाफ 2 : इसके पूर्व मैं उत्तर प्रदेश, मध्य प्रदेश, महाराष्ट्र में रह चुका हूं	Staff 2: Prior to this I had been in UP, MP, Maharashtra.	स्टाफ 2: आ पडेवा इ उत्तर प्रदेश, मध्य प्रदेश, महाराष्ट्रमां रह्यो छुं	स्टाफ 2: आ पहेला हुं उत्तर प्रदेश, मध्य प्रदेश, महाराष्ट्रमां रह्यो छुं	Staaf 2: aa pahelaa hun uttar pradesh, madhy pradesh, maharashtraman rahyo chhun
13	स्टाफ 2: अब गुजरात राज्य भी इस सूची में जुड़ जाएगा.	Staff 2: Now this Gujarat will also be added to this list.	स्टाफ 2: हवे आ यादीमां गुजरात राज्य पण उमेराशे.	स्टाफ 2: हवे आ यादीमां गुजरात राज्य पण उमेराशे.	staaf 2: have aa yadeemaan gujarat raajy pan umeraashe.
14	स्टाफ 1: आइए मैं आपका सभी स्टाफ सदस्यों से मिलवाता हूं.	Staff 1: Let me introduce you to all staff members.	स्टाफ 1: यावो इ तमने तमाम स्टाफ सभ्यो साथे परियि करायुं.	स्टाफ 1: चालो हुं तमने तमाम स्टाफ सभ्यो साथे परिचय करायुं.	Staaf 1 ah chaalo hun tamane tamaam staaf sabhyo sathe parichay karavun.
15	स्टाफ 2 : जी, चलिए.	Staff 2: Yes, let's go	स्टाफ 2: हा, यावो.	स्टाफ 2: हा, चालो.	Staaf 2 : haa, chaalo

सेंट सरल भाषा ष शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

किराने / कपडे के विक्रेता से संवाद Conversation with Grossary / Cloth merchant

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	दुकानदार- नमस्कार, आइए, मैं आपकी क्या सेवा कर सकता हूँ	<b>Shopkeeper-</b> Good morning, please come, may I help you	दुकानदार - हेलो, आवो, हुं तमारी शुं सेवा करी शकुं?	दुकानदार - हेलो, आवो, हुं तमारी शुं सेवा करी शकुं?	Dukaanadaar - helo, aavo, hun tamaree shun sevaa karee shakun?
2	ग्राहक - जी मुझे बासमती चावल चाहिए.	<b>Customer-</b> Yes, I would like to buy Basmati Rice.	ग्राहक - मारे बासमती योभा जोईये छे.	ग्राहक - मारे बासमती चोखा जोईये छे.	Graahak - maare baasamatee chokhaa joiie chhe.
3	दुकानदार - मिल जाएंगे.	<b>Shopkeeper-</b> You will get it.	दुकानदार - तमने मणी जशे.	दुकानदार - तमने मळी जशे.	Dukaanadaar - tamane malee jashe.
4	ग्राहक - इनका क्या भाव है ?	<b>Customer-</b> Rate pleases?	ग्राहक - तेमनी कमित शुं छे?	ग्राहक - तेमनी किमत शुं छे?	Graahak - temanee kinmat shun chhe?
5	दुकानदार- जी रू.110/- किलो.	<b>Shopkeeper-</b> Just Rs.110/ Kg	दुकानदार- रू.110/- कगिरा.	दुकानदार- रू.110/- किग्रा.	Dukaanadaar- roo. 110/- kigraa.
6	ग्राहक- दाम कुछ कम करें.	<b>Customer-</b> Lower the price a bit	ग्राहक - कमित थोडी ओछी करो.	ग्राहक - किमत थोडी ओछी करो.	Graahak - kinmat thodee ochhee karo.
7	दुकानदार- एक ही दाम है.	<b>Shopkeeper-</b> Its fixed price.	दुकानदार - समान कमित.	दुकानदार - समान किमत.	Dukaanadaar - samaan kinmat.
8	ग्राहक- मुझे 1 शर्ट भी चाहिए.	<b>Customer-</b> One shirt please.	ग्राहक- मारे 1 शर्ट पण जोईये छे.	ग्राहक- मारे 1 शर्ट पण जोईये छे.	Graahak- maare 1 shart pan joiie chhe.
9	दुकानदार- आप क्लथ सेक्शन में देख सकते है.	<b>Shopkeeper-</b> Please visit cloth section.	दुकानदार- तमे कपडा विभागमां जोई शको छे.	दुकानदार- तमे कपडां विभागमां जोई शको छे.	Dukaanadaar- tame kapadan vibhagaman joiie shako chho.
10	ग्राहक- मुझे एक अच्छी क्वालिटी की सूती शर्ट दिखाइयें.	<b>Customer-</b> I want a good quality cotton shirt.	ग्राहक- मने सारी गुणवत्तानो कोटन शर्ट बतावो.	ग्राहक- मने सारी गुणवत्तानो कोटन शर्ट बतावो.	Graahak- mane saaree gunavattaano kotan shart bataavo.
11	दुकानदार- ये बहुत अच्छी सूती शर्ट है.	<b>Shopkeeper-</b> This a very good Cotton Shirt.	दुकानदार- आ भूब ज सारी गुणवत्तानो कोटन शर्ट छे.	दुकानदार- आ खूब ज सारी गुणवत्तानो कोटन शर्ट छे.	Dukaanadaar- aa khoob j saaree gunavattano kotan shart chhe.
12	ग्राहक-ये कितने की है	<b>Customer-</b> Price?	ग्राहक- कमित शुं छे ?	ग्राहक- किमत शुं छे	Graahak-kimmat shu chhe
13	दुकानदार- रू. 3000/- हजार.	<b>Shopkeeper-</b> Rs. 3000/- .	दुकानदार - रू. 3000/- हजार.	दुकानदार - रू. 3000/- हजार.	Dukaanadaar - Rs 3 hazaar.
14	ग्राहक - कुछ कम कीजिए.	<b>Customer-</b> Any discount.	ग्राहक - कंईक ओछुं करो.	ग्राहक - कंईक ओछुं करो.	Graahak - kniik ochhun karo.
15	दुकानदार-आपको कुल कीमत पर 10% की छूट दे देंगे.	<b>Shopkeeper-</b> We shall give you 10% discount.	दुकानदार- तमने कुल कमित पर 10 टका डिस्काउन्ट आपशे.	दुकानदार- तमने कुल किमत पर 10 टका डिस्काउन्ट आपशे.	Dukaanadaar- tamane kul kinmat par 10 taka diskaaunt aapashe.
16	ग्राहक-कुल कितना हुआ	<b>Customer-</b> how much to pay	ग्राहक - कुल केटला थया?	ग्राहक - कुल केटला थया?	Graahak - kul ketala thaya?
17	दुकानदार- कुल रू.3250/-कैसे भुगतान करेंगे, नकद या कार्ड	<b>Shopkeeper-</b> Rs.3250/-, How will you pay Cash or Card?	दुकानदार- कुल रू. 3250/- रोकड के कार्ड डेवी रीते यूकवशी?	दुकानदार- कुल रू. 3250/- रोकड के कार्ड केवी रीते चूकवशी?	Dukaanadaar- kul Rs. 3250/- rokad ke kard kevee reete chookavsho
18	ग्राहक- मैं कार्ड द्वारा भुगतान करूंगा.	<b>Customer-</b> I shall pay via Card.	ग्राहक- हुं कार्ड द्वारा यूकवशी करीश.	ग्राहक- हुं कार्ड द्वारा चूकवणी करीश.	Graahak- hun kaard dvaaraa chookavane kareesh.

**सोसाईटी में संवाद. Conversation in Society**

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	राघव: नमस्कार, आप कैसे है?	Raghav: Namaskar, how are you ?	राघव: डेवो, डेम छो?	राघव: हेलो, केम छो?	Raaghavah helo, kem chho?
2	सचिव: नमस्कार जी, मैं ठीक हूँ, आप कैसे है?	Secretary: Namaskar sir, I am fine, how are you?	सेक्रेटरी: डेवो सर, हुं ठीक छुं, तमे केम छो?	सेक्रेटरी: हेलो सर, हुं ठीक छुं, तमे केम छो?	Sekretareeah helo sar, hun theek chhun, tame kem chho?
3	राघव : सब ठीक है, आप जानते है कि मैं पत्नी की बीमारी से काफी परेशान हूँ.	Raghav: Everything is fine, you know, I am very upset with my wife's illness.	राघव: बधुं बराबर छे, तमे जाणो छो के हुं मारी पत्नीनी बीमारीथी खूब ज चिंतित छुं.	राघव: बधुं बराबर छे, तमे जाणो छो के हुं मारी पत्नीनी बीमारीथी खूब ज चिंतित छुं.	Raghav;badhun barabar chhe, tame jano chho ke hun maree patneenee beemaareethee khoob j chintit chhun.
4	सचिव : कहिए, मैं आपकी क्या मदद कर सकता हूँ?	Secretary: Tell me, how can I help you?	सचिव: मने कडो, हुं तमने केवी रीते मदद करी शकुं?	सचिव: मने कहो, हुं तमने केवी रीते मदद करी शकुं?	Sachivah mane kaho, hun tamane kevee reete madad karee shakun?
5	राघव : कल पत्नी को लेकर डॉक्टर के पास जाना था, लेकिन मेरी गाड़ी के सामने किसी ने गाड़ी खड़ी कर दी थी.	Raghav: yesterday I had to go to the doctor with my wife, but a car had parked in front of my car.	राघव: मारे गड कावे मारी पत्नी साथे डॉक्टर पासे जवानुं हतुं, पण मारी कारनी सामे कोईए कार ऊभी राखी हती.	राघव: मारे गई काले मारी पत्नी साथे डॉक्टर पासे जवानुं हतुं, पण मारी कारनी सामे कोईए कार ऊभी राखी हती.	Raghavah mare gail kale maree patnee sathe dohtar paase javanun hatun, pan mारी कारनी सामे कोईए कार ऊभी राखी हती.
6	सचिव : तब क्या हुआ ? डॉक्टर के यहाँ गये या नहीं.	Secretary: What? Did you go to the doctor or not?	सचिव: पछी शुं थयुं? तमे डॉक्टर पासे गया के नडी?	सचिव: पछी शुं थयुं? तमे डॉक्टर पासे गया के नहीं?	Sachivah pachhee shun thayun? Tame dohtar pase gayaa ke naheen?
7	राघव : हम लोग एक घंटा देरी से डॉक्टर के यहाँ पहुँचे.	Raghav : We reached the doctor's place an hour late	राघव: अमे डॉक्टरनी जग्याये अके कवाक मोडा पडोय्या.	राघव: अमे डॉक्टरनी जग्याए एक कलाक मोडा पहुँच्या.	Raaghavah ame doktaraneer jagyaae ek kalak moda pahonchyyaa.
8	सचिव : ये तो दु:ख की बात है	Secretary: I'm sorry.	सेक्रेटरी: ते अफसोसनी वात छे	सेक्रेटरी: ते अफसोसनी वात छे	Sekretareeah te afasosaneer vaat chhe
9	राघव : ऐसा प्रति दिन किसी न किसी के साथ होता है.	Raghav: It happens daily to someone or the other.	राघव: आवुं रोज कोई ने कोई साथे थाय छे.	राघव: आवुं रोज कोई ने कोई साथे थाय छे.	Raghava: aavun roj koii ne koii saathe thaay chhe.
10	सचिव: इसका मतलब ड्यूटी पर तैनात गार्ड ध्यान नहीं देता है.	Secretary: This means the guard is not doing duty.	सचिव: अेनो अर्थ अे छे के इरज परनो गार्ड ध्यान आपतो नथी.	सचिव: एनो अर्थ ए छे के फरज परनो गार्ड ध्यान आपतो नथी.	Sachiva: eno arth e chhe ke faraj parano gard dhyaan apato nathee
11	राघव: जी, गार्ड को ध्यान रखना चाहिए.	Raghav: Yes, the guard should take care.	राघव: हा, गार्डे ध्यान राखवुं जोईये.	राघव: हा, गार्डे ध्यान राखवुं जोईए.	Raghavah haa, gaarde dhyaan raakhavun joiee.
12	सचिव : मैं उसे बोलता हूँ	Secretary: I will ask him.	सेक्रेटरी: हुं तेने कडीश	सेक्रेटरी: हुं तेने कहीश	Sekretareeah hun tene kaheesh
13	राघव : ठीक है धन्यवाद.	Raghav: OK, thanks.	राघव: ठीक छे आभाऱ.	राघव: ठीक छे आभाऱ.	raaghavah theek chhe aabhaar.

सेंट सरल भाषा ४ शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

**बैंक शाखा में ग्राहक से संवाद. Conversation with Customer in Branch**

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	ग्राहक: मैं अंदर आ सकता हूँ?	Customer : May I come in	ग्राहक: शुं हुं अंदर आवी शकुं?	ग्राहक: शुं हुं अंदर आवी शकुं?	Graahak: shun hun andar aavee shakun?
2	शाप्र: जी हां, कृपया आये	BM: Yes, Please come in.	शाप्रा: हा, कृपा करीने आवी	शाप्रा: हा, कृपा करीने आवी	Shaapra: haa, kripaa kareene aavo
3	ग्राहक: मुझे बैंक योजनाओं के बारे में जानकारी लेनी थी	Customer : I want to know about Bank's schemes	ग्राहक: मारे बैंकनी योजनाओ वशि जाणवुं छे	ग्राहक: मारे बैंकनी योजनाओ विशेषे जाणवुं छे	grahak: mare benkanee yojanao vishe janavun chhe
4	शाप्र: आप बचत खाता, आवर्ती खाता, एवं सावधि खाता खोल सकते हैं	BM: You may open Saving account, Time deposit & Recurring account.	तमे सेवगिस अकाउन्ट, रिकरिंग अकाउन्ट, अने इक्सिस डिपोजिट अकाउन्ट पोवी शको छे	तमे सेविंग्स एकाउन्ट, रिकरिंग एकाउन्ट, अने फिक्स्ड डिपोजिट एकाउन्ट खोली शको छे	tame seavings ekaaunt, rikaring ekaaunt, ane fiksd depozit ekaaunt kholee shako chho
5	ग्राहक: एक वर्ष हेतु सावधि जमा की ब्याज दर क्या है	Customer: What is the rate of interest for one year FDT.	ग्राहक: अक वरष माटे इक्सिस डिपोजिट पर व्याज दर शुं छे	ग्राहक: एक वर्ष माटे फिक्स्ड डिपोजिट पर व्याज दर शुं छे	graahak : ek varsh maate fiksd dipojhit par vyaaj dar shun chhe
6	शाप्र: 5% वार्षिक	BM: 5% per annum.	5% p.a.	5% p.a.	5% p. A.
7	ग्राहक: एटीएम कार्ड कैसे मिल सकता है.	Customer: How can I get an ATM card	ग्राहक: हुं एटीएम कार्ड केवी रीते मेणवी शकुं?	ग्राहक: हुं एटीएम कार्ड केवी रीते मेळवी शकुं?	Graahak: hun eteem kaard kevee reete melavee shakun?
8	शाप्र: एक फार्म भरना होगा और शाखा के माध्यम से आपको 15 दिनों में कार्ड प्राप्त होगा.	BM: Just fill a form and you will receive the card through branch within 15 days.	अक फोर्म भरवानुं रडेशे अने तमने शाखा द्वारा 15 दिवसनी अंदर कार्ड प्राप्त थशे.	एक फोर्म भरवानुं रहेशे अने तमने शाखा द्वारा 15 दिवसनी अंदर कार्ड प्राप्त थशे.	ek form bharavaanun raheshe ane tamane shaakhaa dvaaraa 15 divasane andar kaard praapt thashe.
9	ग्राहक: मैं सरकारी कर्मचारी हूँ. मुझे गृह ऋण मिल सकता है.	Customer : I am in Govt service. Will get a home loan.	ग्राहक: हुं सरकारी कर्मचारी छुं. हुं होम लोन मेणवी शकुं?	ग्राहक: हुं सरकारी कर्मचारी छुं. हुं होम लोन मेळवी शकुं?	Graahakah hun sarakaree karmacharee chhun. hun hom lon melavee shakun
10	शाप्र: जी मिल सकता है.	BM : Yes you can get it.	शाप्रा: हा, तमे मेणवी शको छे.	शाप्रा: हा, तमे मेळवी शको छे.	haapraa: aa, tame melavee shako chho.
11	ग्राहक: बचत खाते में नामांकन कैसे कर सकते है	Customer:How to nominate in Saving Account	ग्राहक: सेवगिस अकाउन्टमां केवी रीते वारसाई करवी	ग्राहक: सेविंग्स एकाउन्टमां केवी रीते वारसाई करवी	Graahakah seavings ekauntaman kevee reete vaarsai karavee
12	शाप्र: डीए-1 फार्म भरकर नामांकन कर सकते है	BM : By filling DA-1 form nomination can be done.	शाप्रा: वारसाई DA-1 फोर्म भरने करी शकाय छे	शाप्रा: वारसाई DA-1 फोर्म भरने करी शकाय छे	shaapraa: vaarsai da-1 form bhareene karee shakaay chhe
13	ग्राहक: ऋण/जमा की जानकारी ऑनलाइन कैसे कर सकते हैं,	Customer:How could get online informatioin regarding loan or deposit.	ग्राहक: लोन/थापण माहिति ऑनलाइन केवी रीते मणी शके	ग्राहक: लोन/थापण माहिति ऑनलाइन केवी रीते मळी शके	graahakah lon/thaapan maahitee onlaain kevee reete mali shake
14	शाप्र: 9223901111 पर ऋण के लिए एवं 9223502222 पर जमा के लिए मिस्ड कॉल दें आपको पूर्ण जानकारी मिलेगी.	BM: Give missed call at 9223901111 for loan and 9223502222 for deposit. You will get full information.	शाप्रा: लोन माटे 9223901111 अने डिपोजिट माटे 9223502222 पर मसिड कोव करी तमने संपूर्ण वगितो मणशे.	शाप्रा: लोन माटे 9223901111 अने डिपोजिट माटे 9223502222 पर मिस्ड कॉल करी तमने संपूर्ण विगतो मळशे.	shaapraah: lon maate 9223901111 ane dipojhit maate 9223502222 par misd koī karo tamane snpoorn vigato malashe.

**માર્કેટિંગ સંબંધી સંવાદ. Conversation reg. Marketing**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	બેંકર- નમસ્કાર, હમ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સે હૈ. મૈં રાજેશ હૂં. ઓર યે શ્રી સુરેશ હૈ હમ દોનો બેંક મૈં સહાયક પ્રબન્ધક હૈ.	Banker- Hello, we are from Central Bank of India. I am Rajesh and he is Mr.Suresh. Both are working as Asstt Manager in the Bank.	બેંકર- હેલો, અમે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના છીએ. હું રાજેશ છું. અને આ શ્રી સુરેશ છે, અમે બંને બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છીએ.	બેંકર- હેલો, અમે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના છીએ. હું રાજેશ છું. અને આ શ્રી સુરેશ છે, અમે બંને બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છીએ.	Benkar- helo, ame sentral benk of iindiyaanaa chheee. Hun raajesh chhun. Ane aa shree suresh chhe, ame bnne benkaman asistant menejar chheee.
2	વ્યક્તિ - નમસ્કાર, કહિયે ક્યા કામ હૈ.	Person- Hello, what do you want.	વ્યક્તિ - હેલો, મને કહો કે શું કામ છે.	વ્યક્તિ - હેલો, મને કહો કે શું કામ છે.	Vyakti- helo, mane kaho ke shun kaam chhe.
3	બેંકર- સર, આપ કિસ બેંક સે લેન દેન કરતે હૈ	Banker - Sir, which bank do you deal with?	બેંકર - સર, તમે કઈ બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો?	બેંકર - સર, તમે કઈ બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો?	Benkar - sar, tame kaa benkamanthee tranjhekshan karo chho?
4	વ્યક્તિ- ટીએમબી સે.	Person-From TMB.	વ્યક્તિ-TMB તરફથી.	વ્યક્તિ-TMB તરફથી.	Vyakti-TMB tarafathee.
5	બેંકર-સર હમ અપને બેંક કે કુછ નુ ઓફર આપકો બતાના ચાહેંગે	Banker - Sir, we would like to inform you some new offers, launched by our bank.	બેંકર-સર અમે તમને અમારી બેંકની કેટલીક નવી ઓફરો જણાવવા માંગીએ છીએ	બેંકર-સર અમે તમને અમારી બેંકની કેટલીક નવી ઓફરો જણાવવા માંગીએ છીએ	Benkar-sar ame tamane amaree ketaleek navee ofaro janavavaa maangeee chheee
6	વ્યક્તિ - અચ્છા,	Person - Ok,	વ્યક્તિ - ઠીક છે	વ્યક્તિ - ઠીક છે	vyakti - theek chhe
7	વ્યક્તિ- હા, બતાઇએ.	Person- Pl. Tell me	વ્યક્તિ - હા, કહો.	વ્યક્તિ - હા, કહો.	vyakti - haa, kaho.
8	બેંકર- ફેસ્ટિવલ ઓફર મેં હમારા બેંક ગૃહ ઋણ એવં વાહન ઋણ કી પ્રક્રિયા શુલ્ક મેં પૂરી છૂટ પ્રદાન કર રહા હૈ.	Banker- During the festival offer, our bank is offering full waiver of processing fee for Home loan and Vehicle loan.	બેંકર - તેની તહેવારની ઓફરમાં, અમારી બેંક હોમ લોન અને વાહન લોન માટે પ્રોસેસિંગ ફીની સંપૂર્ણ માફી પ્રદાન કરી રહી છે.	બેંકર - તેની તહેવારની ઓફરમાં, અમારી બેંક હોમ લોન અને વાહન લોન માટે પ્રોસેસિંગ ફીની સંપૂર્ણ માફી પ્રદાન કરી રહી છે.	Benkar - tenee tahevaranee ofaramaan, amaaree benk hom lon ane vaahan lon maate prosesing feenee snpoorn maafee pradaan karee rahee chhe.
9	વ્યક્તિ - અચ્છા	Person - Good	વ્યક્તિ - સારું	વ્યક્તિ - સારું	Vyakti - saarun
10	બેંકર- સર યદિ આપ ઘર લેના ચાહતે હૈતો હમારે બેંક કા યહ ઓફર બેહતરીન હૈ.	Banker- Sir if you want to buy ahouse then its the best offer from our Bank.	બેંકર- સાહેબ, જો તમારે ઘર લેવું હોય તો અમારી બેંકની આ ઓફર શ્રેષ્ઠ છે.	બેંકર- સાહેબ, જો તમારે ઘર લેવું હોય તો અમારી બેંકની આ ઓફર શ્રેષ્ઠ છે.	benkar- saahab, jo tamaare ghar levun hoy to amaaree benkaneer aa ofar shreshth chhe.
11	વ્યક્તિ - હા, ઘર ઓર કાર લેને કા મેરા ઇરાદા તો હૈ.	Person - Yes, I would like to buy a house and a car.	વ્યક્તિ - હા, મારે ઘર અને કાર લેવાનો ઇરાદો છે.	વ્યક્તિ - હા, મારે ઘર અને કાર લેવાનો ઇરાદો છે.	Vyakti - haa, maare ghar ane kaar levaano iiraado chhe.
12	બેંકર- સર ગૃહ ઋણ પર હમારી બ્યાજ દર કાફી કમ હૈ. વિશેષતઃ મહિલાઓ હેતુ હમારે બેંક કી ગૃહલક્ષ્મી આવાસ ઋણ યોજના હૈ, જિસમેં બ્યાજ દર ઓર મી કમ હૈ	Banker - Sir our interest rate for home loan is very low. Especially for women our bank has Grihalaxmi home loan scheme in which interest rate is even lower.	બેંકર- સર, હોમ લોન પરનો અમારો વ્યાજ દર ઘણો ઓછો છે. ખાસ કરીને મહિલાઓ માટે અમારી બેંકની ગૃહલક્ષ્મી હાઉસિંગ લોન સ્કીમ છે, જેમાં વ્યાજ દર પણ ઓછો છે.	બેંકર- સર, હોમ લોન પરનો અમારો વ્યાજ દર ઘણો ઓછો છે. ખાસ કરીને મહિલાઓ માટે અમારી બેંકની ગૃહલક્ષ્મી હાઉસિંગ લોન સ્કીમ છે, જેમાં વ્યાજ દર પણ ઓછો છે.	Benkar- sar, hom lon parano amaaro vyaaj dar ghano ochho chhe. Khaas kareene mahilaaoo maate amaaree benkaneer grihalakshmeer haausing lon skeem chhe, jemaan vyaaj dar pan ochho chhe.

**मार्केटिंग संबंधी संवाद. Conversation reg. Marketing**

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	व्यक्ति - पर क्या इस योजना का लाभ मुझे मिल सकता है ?	Person - But may I get the benefit of this Yojana?	व्यक्ति - પણ શું હું આ યોજનાનો લાભ મેળવી શકું?	व्यक्ति - पण शुं हुं आ योजनानो लाभ मेळवी शकुं?	Vyakti - pan shun hun aa yojanano labh melavee shakun
2	बैंकर-सर, आप अपनी पत्नी के साथ संयुक्त रूप से इस योजना का लाभ ले सकते हैं. इसमें एक लाभ यह भी है कि नियम से ऋण चुकाने पर अंतिम 3 से 5 किश्ते माफ की जाएगी.	Banker - Yes sir, you can avail the advantage of this scheme jointly with wife. Another benefit is that the last 3 to 5 installments will be waived off on regular repayment of the loan.	બેંકર- સર, તમે તમારી પત્ની સાથે મળીને આ યોજનાનો લાભ લઈ શકો છો. આમાં એક ફાયદો એ પણ છે કે લોનની નિયમિત ચુકવણી પર છેલ્લા 3 થી 5 હપ્તાઓ માફ કરવામાં આવશે.	बैंकर- सर, तमे तमारी पत्नी साथे मळीने आ योजनानो लाभ लई शको छे. आमां एक फायदो ए पण छे के लोननी नियमित चुकवणी पर छेल्ला 3 थी 5 हप्ताओ माफ करवामां आवशे.	Benkar- sar, tame tamaree patnee sathe maleene aa yojanano labh laii shako chho. Aaman ek fayado e pan chhe ke lonanee niyamat chukavane par chhellaa 3 thee 5 hptao maf karavaman aavashe.
3	व्यक्ति - यह बढ़िया योजना है. इस योजना में लाभ लेने हेतु मुझे क्या करना होगा?	Person - This is a good plan. How I have to take advantage of this scheme?	વ્યક્તિ - તે એક સરસ યોજના છે. આ યોજનાનો લાભ લેવા મારે શું કરવું પડશે?	व्यक्ति - ते एक सरस योजना छे. आ योजनानो लाभ लेवा मारे शुं करवुं पडशे?	Vyakti - te ek saras yojanaa chhe. Aa yojanaano laabh levaa maare shun karavun padashe?
4	बैंकर-सबसे पहले आप हमारे बैंक में एक बचत खाता खोलिए.	Banker- First of all, open a savings account in our Bank.	બેંકર- સૌ પ્રથમ તમે અમારી બેંકમાં બચત ખાતું ખોલો.	बैंकर- सौ प्रथम तमे अमारी बैंकमां बचत खातुं खोलो.	Benkar- sau pratham tame amaaree benkaman bachat khatun kholo.
5	व्यक्ति- ठीक है फिर गृह ऋण.	Person -Ok, then home loan.	વ્યક્તિ- ઓકે પછી હોમ લોન.	व्यक्ति- ओके पछी होम लोन.	Vyakti- oke pachhee hom lon.
6	बैंकर-आपको आवेदन आईटीआर तथा मकान का कोटेशन देना है, फिर बैंक आपकी पात्रतानुसार ऋण प्रदान करेगा.	Banker-You have to give an application, ITR and house quotation then bank will provide you loan as per your eligibility as soon as possible.	બેંકર - તમારે અરજી ITR અને ઘર નું ક્વોટેશન આપવું પડશે, પછી બેંક તમારી યોગ્યતા અનુસાર લોન આપશે.	बैंकर - तमारे अरजी ITR અને घर नुं क्वोटेसन आपवुं पडशे, पछी बैंक तमारी योग्यता अनुसार लोन आपशे.	Benkar - tamaare arajee ITR ane ghar nun kvoteshan aapavun padashe, pachhee benk tamaaree yogyataa anusaar lon aapashe.
7	व्यक्ति - ठीक है, मैं कल ही आपके बैंक में खाता खुलवाऊंगा.	Person - Ok, I will open an account in your bank tomorrow.	વ્યક્તિ - ઠીક છે, હું કાલે જ તમારી બેંકમાં ખાતું ખોલાવીશ.	व्यक्ति - ठीक छे, हुं काले ज तमारी बैंकमां खातुं खोलावीश.	Vyakti - theek chhe, hun kaale j tamaaree benkamaan khaatun kholaaveesh.
8	बैंकर- अपने बैंक के ग्राहक के रूप में आपको जोड़कर हमें बहुत प्रसन्नता है. धन्यवाद सर.	Banker - We are glad to add you as a customer of our bank. Thanks a lot.	બેંકર- તમને અમારી બેંકના ગ્રાહક તરીકે ઉમેરવામાં અમને ખૂબ આનંદ થાય છે. આભાર સર.	बैंकर- तमने अमारी बैंकना ग्राहक तरीके उमेरवामां अमने खूब आनंद थाय छे. आभार सर.	Benkar- tamane amaree benkanaa grahak tareeke umeravaman amane khoob annd thaay chhe. Aabhar sar.
9	व्यक्ति - इतनी महत्वपूर्ण जानकारी देने हेतु आपको भी धन्यवाद.	Person - Thanks to you too for giving such important information.	વ્યક્તિ - આવી મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ તમારો પણ આભાર.	व्यक्ति - आवी महत्वपूर्ण माहिती आपवा बदल तमारो पण आभार.	Vyakti - aavee mahatvapooran maahitee apava badal tamaro pan aabhar.



**ફલ સબ્જી વિક્રેતા સે સંવાદ. Conversation Fruits/ Vegetables seller**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	ગ્રાહક - ભઈયા આલૂ ક્યા ભાવ દિયે હૈં ?	Customer : What is the rate of Potato.	ગ્રાહક - ભાઈ, બટાકાની કમિત શું છે?	ગ્રાહક - ભાઈ, બટાકાની કિમત શું છે?	Graahak - bhaaaii, batakaanee kinmat shun chhe?
2	વિક્રેતા- સાહબ બીસ રુપયે કિલો.	Seller- Sir, 20 Rupee Kg.	વિક્રેતા- સર વીસ રૂપિયા કલો.	વિક્રેતા- સર વીસ રૂપિયા કિલો.	Vikretaa- sar vees roopiyaa kilo.
3	ગ્રાહક - બીસ રુપયે? इतना	Customer : 20 Rupees? Too much	ગ્રાહક - વીસ રૂપિયા? આટલું બધું	ગ્રાહક - વીસ રૂપિયા? આટલું બધું	Graahak-vees roopiya? Aatalun badhun
4	વિક્રેતા - સાહબ आज मंहगे हें.	Seller - Sir, today it is costly.	વિક્રેતા - સાહેબ આજે મોઘી છે.	વિક્રેતા - સાહેબ આજે મોઘી છે.	vikretaa - saaheb aaje monghee chhe.
5	ગ્રાહક - पन्द्रह नहीं दोगे.	Customer : Give at 15?	ગ્રાહક - પંદર માં નહી આપો ?	ગ્રાહક - પંદર માં નહી આપો ?	Graahak - pandar maan naheen aapo ?
6	सब्जी विक्रेता - नहीं साहब.	Seller - Sorry Sir.	શાકભાજી વેચનાર - ના સાહેબ.	શાકભાજી વેચનાર - ના સાહેબ.	Shakabhajee vechanaar - naa saaheb.
7	ग्राहक- अच्छा दो किलो दे दो?	Customer: OK, Give two Kg.	ગ્રાહક- સારું બે કલો આપો?	ગ્રાહક- સારું બે કિલો આપો?	Graahak- saarun be kilo aapo?
8	सब्जी विक्रेता - तोरई भी ताजी है साहब .	Seller - Sir Sponge groud is also fresh.	શાકભાજી વેચનાર - તૂરિયું પણ તાજી છે સાહેબ.	શાકભાજી વેચનાર - તૂરિયું પણ તાજી છે સાહેબ.	Shakabhajee vechanar - tooriyun pan taajee chhe saaheb.
9	ग्राहक - कैसे दी है .	Customer : Price?	ગ્રાહક - તે કેવી રીતે આપવામાં આવે છે?	ગ્રાહક - તે કેવી રીતે આપવામાં આવે છે?	Graahak- te kevee reete apavaman aave chhe?
10	विक्रेता-आपको 10 रुपये किलो .	Seller- 10 Rupee Kg for you.	વિક્રેતા- તમને 10 રૂપિયા કલો મળશે.	વિક્રેતા- તમને 10 રૂપિયા કિલો મળશે.	Vikretaa- tamane 10 roopiyaa kilo malashe.
11	ग्राहक- ठीक है एक किलो दे दो. लेकिन पहले मुझे चुनने दो.	Customer: OK, Give me 1 kg. But let me choose first.	ગ્રાહક- ઠીક છે મને એક કલો આપો. પણ પહેલા મને પસંદ કરવા દો.	ગ્રાહક-ઠીક છે મને એક કિલો આપો. પણ પહેલા મને પસંદ કરવા દો.	Graahak- theek chhe mane ek kilo apo. Pan pahela mane pasnd karava do.
12	विक्रेता - ताजा सेब भी देखिये साहब.	Seller - Sir, see the fresh apples also.	વિક્રેતા-તાજા સફરજન પણ જુઓ સાહેબ.	વિક્રેતા- તાજા સફરજન પણ જુઓ સાહેબ.	Vikretaa- taja safarajan pan juo saaheb.
13	ग्राहक - कैसे दिये हैं.	Customer : Rate?	ગ્રાહક- કમિત?	ગ્રાહક - કિમ્મત?	Graahak - kimmatt?
14	सब्जी विक्रेता - एक सौ पचास.	Seller - Rs 150/-	શાકભાજી વેચનાર - એકસો અને પચાસ.	શાકભાજી વેચનાર - એકસો અને પચાસ.	Shakabhajee vechanar - ekaso ane pachaas.
15	ग्राहक - नहीं भाई, मंहगे हें.	Customer : No too costly, .	ગ્રાહક - ના ભાઈ, તે મોઘા છે.	ગ્રાહક - ના ભાઈ, તે મોઘા છે.	Graahak - naa bhaaaii, te monghaa chhe.
16	सब्जी विक्रेता - कितने लोगे ?	Seller-How much you want	શાકભાજી વેચનાર - કેટલા લેસો ?	શાકભાજી વેચનાર - કેટલા લેસો ?	Shakabhajee vechanar - ketalaa lesa ?

सेंट सरल भाषा ४ शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

उधारकर्ता से वसूली संबंधी संवाद. Conversation with Borrower for Recovery

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	स्टाफ - नमस्कार, आप हमारी बैंक शाखा के खातेदार है. हम आपसे मिलने आए हैं.	Staff - Hello, You are our bank Account holder. We would like to meet you	स्टाफ - डेलो, तमे अमारी बेंक शाखाना ખાતાધારક છો. તમને મળવા આવ્યા છીએ	स्टाफ - हेलो, तमे अमारी बैंक शाखाना खाताधारक छो. तमने मळवा आव्या छीए	Staaf- helo, tame amaree benk shakhana khatadharak chho. Tamane malava avyaa chheee
2	ग्राहक - नमस्कार. कृपया अपने आने का उद्देश्य बताएं?	Customer - Hello. Please tell me the purpose of your visit?	ग्राहक - डेलो. કૃપા કરીને તમારી મુલાકાતનો હેતુ જણાવો	ग्राहक - हेलो. कृपा करीने तमारी मुलाकातनो हेतु जणावो	Graahak - helo. Kripaa kareene tamaaree mulaakaatano hetu janavo
3	स्टाफ- महोदय हमें आपके ऋण खाते के संबंध में चर्चा करनी है.	Staff - Sir, we would like like to discuss you loan account.	स्टाफ- सर અમે તમારા લોન ખાતા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ.	स्टाफ- सर अमे तमारा लोन खाता अंगे चर्चा करवा मांगीए छीए.	Staaf- sar ame tamaaraa lon khaataa ange charchaa karavaa maangeee chheee.
4	ग्राहक- जी, आपके बैंक में मेरा एक बचत और एक ऋण खाता है, मैं नियम से किश्त भरता हूँ.	Customer- Yes, I have a savings & a loan account in your bank and paying regular installments.	ગ્રાહક- સાહેબ, તમારી બેંકમાં મારું બચત અને લોન ખાતું છે, હું નયિમ મુજબ હપ્તા ભરું છું.	ग्राहक- साहेब, तमारी बैंकमां मारुं बचत अने लोन खातुं छे, हुं नियम मुजब हप्ता भरुं छुं.	Grahak- saheb, tamaree benkaman marun bachat ane lon khatun chhe, hun niyam mujab hapta bharun chhun.
5	स्टाफ - लेकिन विगत तीन माह से इस खाते में किश्तें नहीं भरी गई है तथा आपके बचत खाते में भी पर्याप्त राशि नहीं है.	Staff - But last 3 installments are unpaid in this account and your savings account is not having sufficient funds.	स्टાફ - પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ ખાતામાં હપ્તા ભરવામાં આવ્યા નથી અને તમારા બચત ખાતામાં પણ પૂરતી રકમ નથી.	स्टाफ - परंतु छेल्ला त्रण महिनाथी आ खातामां हप्ता भरवामां आव्या नथी अने तमारा बचत खातामां पण पूरती रकम नथी.	Staaf - parntu chhella tran mahinathee aa khataman hapta bharavaman avya nathee ane tamaara bachat khataman pan pooratee rakam nathee
6	स्टाफ- हम किश्त जमा न करने का कारण जान सकतेहैं	Staff - Can we know the reason for its non payment ?	स्टાફ- હપ્તો જમા ન કરાવવાનું કારણ જાણી શકીએ?	स्टाफ- हप्तो जमा न कराववानुं कारण जाणी शकीए?	Staaf- hopto jamaa n karaavavaanun kaaran jaanee shakeee?
7	ग्राहक - जीहां. विगत तीन माह से मुझे आधा ही वेतन प्राप्त हुआ है जिसके कारण मैं इन्हें समय पर नहीं चुका पाया हूँ.	Customer - Yes, for last 3 months, I am getting just half salary so the same was not paid on time.	ગ્રાહક - હા. છેલ્લા ત્રણ મહિનાથી મને અડધો જ પગાર મળ્યો છે, જેના કારણે હું સમયસર હપ્તા ચૂકવી શક્યો નથી.	ग्राहक - हा. छेल्ला त्रण महिनाथी मने अडधो ज पगार मळ्यो छे, जेना कारणे हुं समयसर हप्ता चूकवी शक्यो नथी.	Grahak - ha. Chhella tran mahinathee mane adadho j pagaar malyo chhe, jenea karane hun samayasar hapta chookavee shakyo nathee.
8	स्टाफ - हमें इसका दुख है.	Staff - Sorry for it.	स्टાફ - અમે આ માટે દલિગીર છીએ.	स्टाफ - अमे आ माटे दिलगीर छीए.	Staaf - ame aa maate dilageer chheee.
9	ग्राहक-कंपनीमालिक का कहना है कि जैसे ही महामारी का प्रभाव कम होगा, हम सभी कर्मचारियों को एरियर्स के साथ पूरा वेतन मिल जाएगा.	Customer - The owner says that as soon as the impact of the epidemic will reduce, all employees will get full salary with Arrears	ગ્રાહક - કંપનીના માલિકનું કહેવું છે કે મહામારીની અસર ઓછી થતાં જ અમારા તમામ કર્મચારીઓને બાકી રકમની સાથે સંપૂર્ણ પગાર પણ મળી જશે.	ग्राहक - कंपनीना मालिकनुं कहेवुं छे के महामारीनी असर ओछी थतां ज अमारा तमाम कर्मचारीओने बाकी रकमनी साथे संपूर्ण पगार पण मळी जशे.	Grahak - knpaneena maalikanun kahevun chhe ke mahamarinie asar ochhee thataan j amara tamam karmachareone baakee rakamane sathe snpoorn pagar pan malee jashe.

सेंट सरल भाषा ई शिक्षण सेंट सरल भाषा ई शिक्षण Cent Saral Bhasha E - Learning

ग्राहक के घर वसूली कार्य संबंधी संवाद. Conversation with borrower for recovery

क्रम	हिन्दी	अंग्रेजी	गुजराती		
			गुजराती	देवनागरी लिपि	रोमन लिपि
1	स्टाफ-क्या आप आज अतिदेय किश्त की अदायगी करने की स्थिति में है.	Staff - Are you in a position to repay the overdue installment today.	स्टाफ - शुं तमे आजे मुदतवीती इप्ती यूकववानी स्थितिमां छी?	स्टाफ - शुं तमे आजे मुदतवीती हप्तो चूकववानी स्थितिमां छी	Staaf - shun tame aaje mudataveetee hapto chookavavanee sthitimaan chho?
2	ग्राहक - यह कष्टका समय है तथापि मैं अपने रिश्तेदारों की मदद से अतिदेय किश्त देने का प्रयास करता हूँ.	Customer-It is a painful time, however, I try to pay overdue installment with the help of my relatives	ग्राहक - ते मुश्केल समय छे, जोके हुं मारा संबंधीओनी मददथी मुदतवीती इप्ताओने इबयिर करवानी प्रयास करुं छुं.	ग्राहक - ते मुश्केल समय छे, जोके हुं मारा संबंधीओनी मददथी मुदतवीती हप्ताओने क्लियर करवानी प्रयास करुं छुं.	Grahak - te mushkel samay chhe, joke hun mara snbndheeonee madadathee mudataveetee haptaon kliyar karavano prayas karun chhun.
3	स्टाफ- यह बताना हमारा कर्तव्य है कि यदि आपका ऋण खाता एनपीए हो जाता है तो आपको भविष्य में वित्तीय संस्थानों से ऋण मिलना संभव नहीगा	Staff- It is our duty to inform that if loan account becomes NPA then it will not be possible to get a loan from financial institutions in future.	स्टाफ- ये जणाववुं अमारुं करतव्य छे के जो तमारुं लोन पातुं NPA थई जशे तो भवषियमां नाणाकीय संस्थाओ पासेथी लोन मेणववी शक्य नई बने.	स्टाफ- ए जणाववुं अमारुं कर्तव्य छे के जो तमारुं लोन खातुं NPA थई जशे तो भविष्यमां नाणाकीय संस्थाओ पासेथी लोन मेळववी शक्य नहीं बने.	Staf- e janavavun amaarun kartavy chhe ke jo tamarun lon khatun npa thaii jashe to bhavishyaman nanakeey snsthao pasethi lon melavavee shaky naheen bane.
4	स्टाफ- इसके अलावा आपके बच्चों को उच्च शिक्षा हेतु बैंक ऋण मिलने में कठिनाई होगीजिससे उनका भविष्य खराब होने की आशंका बनी रहेगी.	Staff-Further, your children will face difficulty to get bank loans for higher education, due to which there will be a fear of their future being spoiled.	स्टाफ - आ सिवाय तमारा बाणकोने उय्य शक्षिष माटे बेंक लोन मेणववामां मुश्केली पडशे, जेना कारणे तेमनुं भवषिय बगडवानी संभावना रहेशे.	स्टाफ - आ सिवाय तमारा बाळकोने उच्च शिक्षण माटे बेंक लोन मेळववामां मुश्केली पडशे, जेना कारणे तेमनुं भविष्य बगडवानी संभावना रहेशे.	Staaf - aa sivay tamara balakone uchch shikshan mate benk lon melavavaman mushkelee padashe, jena karane temanun bhavishy bagadavane snbhaavanaa raheshe.
5	स्टाफ - एक और जानकारी कि यदि आप समय पर ऋण चुकाते हैं तो आप बैंक के मूल्यवान उधारकर्ता हो जाएंगे तथा भविष्य में नया ऋण देने में बैंक द्वारा आपको प्राथमिकता प्रदान की जाएगी.	Staff - Another information I have to give you that if you repay the loan timely, you will be our valuable customer and be given priority by the bank in future new loans.	स्टाफ - हुं बीजी माडती आपुं के जो तमे समयसर लोननी युक्वणी करशी, तो तमे बेंकना मूल्यवान उधार लेनार बनी जशी अने भवषियमां नवी लोन आपवामां बेंक द्वारा तमने प्राथमिकता आपवामां आवशे.	स्टाफ - हुं बीजी एक उपयोगी माहिती आपुं के जो तमे समयसर लोननी चुकवणी करशी, तो तमे बेंकना मूल्यवान उधार लेनार बनी जशी अने भविष्यमां नवी लोन आपवामां बेंक द्वारा तमने प्राथमिकता आपवामां आवशे.	Staaf - hun beejee ek mahitee apun ke jo tame samayasar lonanee chukavane karasho, to tame benkana moolyavan udhar lenar bane jasho ane bhavishyaman navee lon apaaman benk dvara tamane prathamikata apavaman avashe.
6	ग्राहक-आपका मार्ग दर्शन अति शिक्षाप्रद है. मैं विश्वास दिलाता हूँ कि मेरा ऋण खाता कभी भी खराब नहीं होगा.	Customer - Your guidance is very usefull. I assure you that my loan account will never be bad.	ग्राहक- साडेब तमारुं मार्गदर्शन भूब ज उपदेशक छे. हुं खातरी आपुं छुं के मारुं क्यारेय बगडशे नई.	ग्राहक- तमारुं मार्गदर्शन खूब ज उपदेशक छे. हुं खातरी आपुं छुं के मारुं लोन खातुं क्यारेय बगडशे नहीं.	Grahak- b tamarun margadarshan khoob j upadeshak chhe. Hun khataree apun chhun ke marun lon khatun kyarey bagadashe naheen.

સેન્ટ સરલ ભાષા ઈ શિક્ષણ સેન્ટ સરલ ભાષા ઈ શિક્ષણ Cent Saral Bhasha E - Learning

**બસ અડ્ડે પર સંવાદ . Conversation at Bus Stand**

ક્રમ	હિન્દી	અંગ્રેજી	ગુજરાતી		
			ગુજરાતી	દેવનાગરી લિપિ	રોમન લિપિ
1	વ્યક્તિ - દિલ્લી કી બસ કિતને બજે જાયેગી?	Person - At what time will the Delhi bus leave?	વ્યક્તિ - દલ્હી બસ કેટલા વાગે રવાના થશે?	વ્યક્તિ - દિલ્હી બસ કેટલા વાગે રવાના થશે?	Vyakti - dilhee bas ketalaa vaage ravaanaa thashe?
2	કર્મચારી - દિલ્લી કી બસ 7 બજે જાયેગી.	Employee - The Delhi bus will leave at 7.00 o'clock.	કર્મચારી - દલ્હી બસ 7 વાગ્યે ઉપડશે.	કર્મચારી - દિલ્હી બસ 7 વાગ્યે ઉપડશે.	Karmachaaree - dilhee bas 7 vaagye upadashe.
3	વ્યક્તિ - યહાં સે દિલ્લી કા કિરાયા કિતના હૈ?	Person - What is the fare from here to Delhi?	વ્યક્તિ - અહીંથી દલ્હીનું ભાડું કેટલું છે?	વ્યક્તિ - અહીંથી દિલ્હીનું ભાડું કેટલું છે?	Vyakti - aheenthee dilheenun bhaadun ketalun chhe?
4	કર્મચારી - સત્તર રુપયે હૈ.	Employee - Seventy rupees	કર્મચારી - સત્તિરે છે રૂ.	કર્મચારી - સિત્તેર છે રૂ.	Karmachaaree - sitter chhe roo.
5	વ્યક્તિ - દિલ્લી પહુંચને મેં કિતના સમય લગેગા ?	Person - How long will it take to reach Delhi?	વ્યક્તિ - દલ્હી પહોંચવામાં કેટલો સમય લાગશે?	વ્યક્તિ - દિલ્હી પહોંચવામાં કેટલો સમય લાગશે?	Vyakti - dilhee pahonchavaman ketalo samay laagashe?
6	કર્મચારી - દો ઘંટે લગેગે.	Employee - Two hours.	સ્ટાફ - તે બે કલાક લેશે.	સ્ટાફ - તે બે કલાક લેશે.	Staaf - te be kalaak leshe.
7	વ્યક્તિ - સ્ટેશન કે લિપે કૌન સે નંબર કી બસ જાયેગી?	Person - Which number bus will go to the Station?	વ્યક્તિ - સ્ટેશન પર કયા નંબરની બસ જશે?	વ્યક્તિ - સ્ટેશન પર કયા નંબરની બસ જશે?	Vyakti - steshan par kayaa nambaranee bas jashe?
8	કર્મચારી - સ્ટેશન કે લિપે 112 નંબર કી બસ જાયેગી.	Employee - Number 112 bus will go to the Station.	સ્ટાફ - 112 નંબરની બસ સ્ટેશન જશે.	સ્ટાફ - 112 નંબરની બસ સ્ટેશન જશે.	Staaf - 112 nambaranee bas steshan jashe.
9	વ્યક્તિ - દિલ્લી કે લિપે સ્લીપર બસ કિતને બજે જાતી હૈ. ?	Person - At what time does sleeper bus leave to Delhi?	વ્યક્તિ - સ્લીપર બસ કેટલા વાગે દલ્હી જવા રવાના થાય છે. ?	વ્યક્તિ - સ્લીપર બસ કેટલા વાગે દિલ્હી જવા રવાના થાય છે. ?	Vyakti - sleeper bas ketalaa vaage dilhee javaa ravaanaa thaay chhe. ?
10	કર્મચારી - દિલ્લી કે લિપે સ્લીપર બસ 8 બજે જાતી હૈ.	Employee - Sleeper bus to Delhi leaves at 8 o'clock.	કર્મચારી - સ્લીપર બસ 8 વાગ્યે દલ્હી જવા રવાના થાય છે.	કર્મચારી - સ્લીપર બસ 8 વાગ્યે દિલ્હી જવા રવાના થાય છે.	Karmachaaree - sleeper bas 8 vaagye dilhee javaa ravaanaa thaay chhe.
11	વ્યક્તિ - સમય સારણી કહાં પર લગી હુઈ હૈ	Person - Where is the time table displayed?	વ્યક્તિ - સમય પત્રક ક્યાં સ્થિત છે?	વ્યક્તિ - સમય પત્રક ક્યાં સ્થિત છે?	Vyakti - samay patrak kyaan sthit chhe?
12	કર્મચારી - સમય સારણી ઠીક આપકે પીછે લગી હુઈ હૈ.	Employee - Time table is displayed behind you.	સ્ટાફ - ટાઈમ ટેબલ તમારી પાછળ છે.	સ્ટાફ - ટાઈમ ટેબલ તમારી પાછળ છે.	Staaf - taaiim tebal tamaree pachhal chhe.
13	વ્યક્તિ - કયા માસિક પાસ કી સુવિધા ઉપલબ્ધ હૈ?	Person - Is monthly pass facility available?	વ્યક્તિગત - શું માસિક પાસની સુવિધા ઉપલબ્ધ છે?	વ્યક્તિગત - શું માસિક પાસની સુવિધા ઉપલબ્ધ છે?	Vyaktigat - shun masik pasanee suvidhaa upalabdh chhe?
14	કર્મચારી - જી હા, માસિક પાસ કી સુવિધા ઉપલબ્ધ હૈ.	Employee - Yes, monthly pass facility is available.	કર્મચારીઓ - હા, માસિક પાસની સુવિધા ઉપલબ્ધ છે.	કર્મચારી - હા, માસિક પાસની સુવિધા ઉપલબ્ધ છે.	Karmachareeo - haa, maasik paasanee suvidha upalabdh chhe.

\*\*\*\*\*